

22 JAN 1952

INDIAN OPINION

Founded by
• MAHATMA GANDHI •
• IN 1903 •

No. 2—Vol. L.

FRIDAY 18TH JANUARY, 1952.

Registered at the G.P.O. as a Newspaper.
Price SIX PENCE



BUT MIND IT NOT . . .

It may be that your loved ones will forsake you, but mind it not, my friend.

It may be that the creeper of your hope will be laid low in the dust all torn, its fruits wasted—but mind it not, my friend.

It may be that the dark night will overtake you before you reach the gate, and your attempts will ever be in vain to light your lamp.

When you tune your harp, the birds and the beasts of the wilderness will flock around you. It may be that your brothers will remain unmoved, but mind it not, my friend.

The walls are of stones, the doors barred. It may, be that you will knock off and again, yet it will not open—but mind it not, my friend.

—Tagore.



JUST UNPACKED!

Latest SILKS & SAREES.



44" Wide
CRAPON—
—GEORGETTE
Special Price 3/11 yd.
.....
44" Printed Georgette
Pin Spot & Floral
All Over Designs
5/6 yard

44" OPAL GEORGETTE
In all shades ... 15/6 yd.
44" EMBOSSED GEORGETTE
Beautiful Floral & Basket Design 12/6 yd.
44" VELVET CHENILE GEORGETTE
17/6 yd.
36" RING VELVET uncrushable 15/11 yd.
36" COLOURED SATIN
BEAUTE 6/11 yd.
36" COLOURED SATIN 3/11 yd.
ALL SHADES IN STOCK.
—
CHILDREN'S GEORGETTE SMOKED
FROCKS. EXCELLENT WORK 21/- each.
—
Sarce Borders, Jari Trimmings Always
In Stock.

LATEST
STYLES
IN
MEN'S
LADIES'
&
CHILDREN'S
CHAMPALS.

EMBROIDERED GEORGETTE SAREES. In all leading shades. Now reduced to £4/10/- each.
—
EMBROIDERED SUEDE SILK SAREES. Attractive Embroidery. Special price £4/4/- each.
—
GEORGETTE JARI WORK SAREES, with attractive wide borders in all shades. Now reduced to £5/10/-
—
PRINTED VOILE SAREES
In Latest Designs
5 Yds Lengths 25/- each.
6 " " 30/- each.

44 "Wide
HEAVY QUALITY
COLOURED GEORGETTE
All shades In Stock.
Special Offer 4/11 Yard
.....
44" Coloured Georgette
with double printed border
Sky-White & Green
6/6 Yard

Phone 33-6229. **JAYBEE SILK HOUSE** P. O. Box 5169.
39a MARKET STREET, JOHANNESBURG.

BONES WANTED

We Pay
£7 PER TON
F.O.R. your
Station or Siding

BAGS RETURNED RAILAGE PAID


For Full Particulars write to:

THE
BULLBRAND FERTILIZERS LTD.

SARNIA, NATAL.

ELGIN

21 Jewel Lord Elgin and 17 Jewel Elgin De Luxe in Solid Gold and Gold Filled Cases.
Latest models 15 Jewel Elgins in Gold Filled Cases.



WITH THE
NEW MIRACLE
DURA-POWER MAINSPRING
ADVANCE 1950 MODELS

KATZ & LOURIE LTD.

Cor. Eloff & Market Sts., JOHANNESBURG.

HANNON'S DETECTIVE AGENCY (PTY.) LTD.
Managing Director: O. HANNON, seventeen years Royal Irish Constabulary and Criminal Investigation Department, S.A. Police.
Manager: MINDEN PLUMLEY, ex-Hendon Police College and Criminal Investigation Department, New Scotland Yard, London.
Criminal, Commercial and Matrimonial Investigations Carried Out
In Strictest Confidence.
11/12 Paston Chambers, Jeppe Street, P.O. Box 5199 Johannesburg
Phones:—Office: 22-7771. After hours: 24-4544.

Kasturba Gandhi Memorial Number
Copies of Kasturba Gandhi Memorial Number can be had at this office at 1s. 3d. including postage.
'Indian Opinion'
Phoenix, Natal.

The
New India Assurance
 Company Limited

for
FIRE, MARINE, LIFE, ACCIDENT
1919-1950
31 YEARS OF SUSTAINED PROGRESS

**WANTED AGENTS in the Union of South Africa for
 Life, Fire, Marine And Accident Business.**

Apply giving full details to:-

RUSTOMJEE (PTY.) LTD.,

Principal Controlling Officers,

New India Assurance Company Limited

74 Victoria Street, Durban.

AS OTHERS SEE US

Extract from the "Review" (London) of 29-9-1950

A LEADING INSURANCE JOURNAL

"The Business of the New India has developed very strongly in the past three years with successive increases."

"The FIRE ACCOUNT has a remarkable record of sustained property."

"The MARINE FUND is more than double (237) per cent the amount required."

"The ACCIDENT ACCOUNT has an even more magnificent profit record . . . over the past 10 years."

"LIFE BUSINESS: Life Department has been writing comparatively big business for the past 5 years."

The confidence of the discerning Public in the NEW INDIA is amply evidenced by the following records attained in 1949:

| Rs. | | Rs. | |
|-----------------------|-------------|------------------------|--------------|
| Fire Premium | 1,70,32,179 | Life Business in force | |
| Marine Premium | 56,04,844 | exceeds | 54,34,00,000 |
| Miscellaneous Premium | 35,84,968 | Assets exceed | 15,36,00,000 |
| Life Premium | 2,88,79,302 | Total claims paid over | 17,95,00,000 |

In the vanguard of Indian Insurance THE NEW INDIA offers matchless Security and Service in all fields of Insurance.

The

New India Assurance Company Limited

Cable & Telegraphic
 Address:

"RUSTOMJEE" or
 "NIASURANCE"

RUSTOMJEE (PTY.) LTD

Directors: Sorabjee Rustomjee
 Rustom Jalbhoy Rustomjee

Principal Controlling Officers in the Union of South Africa

Phone Nos: 25845, 29807 & 8513.—P.O. Box 1610.

74 Victoria Street, DURBAN, NATAL.

**EXPERIENCED,
 RELIABLE
 AGENTS
 MAY APPLY**

"NEW INDIA IN THE SERVICE OF THE NATION"



B. I. S. N. Co. Ltd.

S.S. Kampala will sail for Bombay on 2nd February

Passengers must conform with the Vaccination and Yellow Fever inoculation requirements and obtain certificates from their nearest District Surgeon. Inoculation by and certificates from private Medical Practitioners will not be accepted.

FARES : DURBAN TO BOMBAY

| | | | |
|------------------|--------------|--------------|----------|
| First Class | single | without food | £75-15-0 |
| Second " | " | " | 50-13-0 |
| Inter-Class | " | " | 34-3-0 |
| Unberthed (Deck) | without food | | 21-3-0 |

Muslim Special Food £11-10-0 Ordinary Food £5-0-0
Hindu Special Food £10-3-0 Ordinary Food £4-5-6

Bookings for 1st, 2nd, Inter-Class and Unberthed (Deck) can be effected by communication with us by telegram or letters.

Under no circumstances will unberthed passengers be permitted to keep on deck with them more than one bedding roll and one trunk for use during the voyage.

For further particulars apply to—

SHAIK HIMED & SONS (PTY) LTD.

390 FINE STREET, Telephone 20432, DURBAN.
Tel. Add.: "KARAMAT."

YOUR GARDEN'S SUCCESS—Begins with Good Seed

Our Long Experience is your Guarantee

Try our Famous

**IMPORTED & GOVT. CERTIFIED
VEGETABLE & FLOWER SEEDS**

Available in Bulk and Packets

A. B. NAIDOO & SONS

(Established 1917)

Stockists of:—

GRAIN, FERTILIZER, HOES, PLOUGH PARTS,
HARDWARE & GROCERIES at Competitive Prices.

Phone 21213. Tel. Add.: "GREENFEAST."
145 Brook Street, DURBAN.

WE SELL ONLY ONE GRADE OF SEEDS - ABSOLUTELY THE BEST.

DHIRUBHAI P. NAIK

Insurance & General Agent

For Life, Fire, Burglary, Riot, Accident, Plate Glass, etc.

Representative: National Mutual Life Assn Of Australasia,
Yorkshire Insurance Co. Ltd.

Consult Us For Your Income Tax, Personal
Tax, Revenue Clearance Certificate And
Immigration Matters.

Telephone: 32-9033. 29e Commissioner Street,
JOHANNESBURG.

EVERY



FRIDAY from
NAIROBI—

A Constellation leaves for KARACHI and BOMBAY with immediate connections for all parts of

**INDIA and
PAKISTAN**

This is the fastest, most direct and most comfortable route, IMMEDIATE BOOKINGS AVAILABLE.

"CARGO ACCEPTED"



AIR-INDIA

Incorporated
in India

Members of I.A.T.A.

International LTD.

P.O. Box 3006, NAIROBI. Cables "AIRINDIA"
For details apply to I.A.T.A. Agents and Airlines.

Always Better. Better Always.

Are Kapitan's Tempting
Sweetmeats.



For nearly half a century we are leading in the
manufacture of Quality Sweetmeats and Cakes.

TRY US FOR THE LATEST INDIAN RECORDS.

Address:

KAPITANS BALCONY HOTEL,

(KORNER SWEETMEAT HOUSE)
Corner Grey and Victoria Streets,
DURBAN.

Phone 23414.

Tel. Add. 'KAPITANS.'

**SHAVING
COSTS LESS**



Sixpence for four blades—
that's all you pay for Minora
blades! And because they're
made from the finest steel,
they stay sharp longer,
giving you more shaves,
better shaves. Look for
Minora blades in the red,
white and yellow packet.



4 BLADES FOR 6d.

INDIAN OPINION

Founded by
MAHATMA GANDHI
IN 1903.

No. 2—VOL.—L.

FRIDAY, 18TH JANUARY, 1952

Registered at the G.P.O. as a Newspaper.
Price SIX PENCE

Indian Opinion

FRIDAY, 18TH JANUARY, 1952

Individual Action

MR. MANILAL GANDHI, in his article on the Bloemfontein Conference last week said that to fight against the injustices imposed by the Government there was not that preparedness in us to conduct mass action and that the best course to adopt was individual action. This merits serious consideration by all those who wish to fight the Government with the clean weapon of Passive Resistance and are sincere and earnest about it. Those who do not desire to do so and are not earnest will of course work along their own lines and we repeat that they will bring misery to the people concerned and nothing but chaos in the country. The reason why individual action is suggested is because it will be possible then to ensure that the struggle will remain absolutely pure. It will be possible to have only those of whom we can be sure that they will never betray our cause; they will have thoroughly grasped the true meaning of Passive Resistance and will remain true to its principles. It will be possible to keep a check on every Passive Resister and to get a proper account of himself.

It is folly to believe that the struggle cannot be successful unless it is a mass struggle. Passive Resistance always depends on

quality, never on quantity. We must have an army of a hundred, two hundred or five hundred true Passive Resisters. If we say that is impossible, it only proves that we are not ready to fight.

In 1930, Mahatma Gandhi started the struggle in India with eighty Passive Resisters who had passed the test in every respect. It turned into a mass struggle of its own accord. It did not require speeches to rouse the emotional feelings of the people. We have to appeal to the hearts of the people and to awaken their conscience which will automatically awaken by the actions of the leaders.

In Passive Resistance the motive is never to embarrass or to coerce the evil-doer because we do not hate the evil-doer; we hate the evil and we therefore refuse to submit to the evil and invite upon ourselves the wrath of the evil-doer. If the evil-doer feels embarrassed or coerced thereby it is not our fault. We only wish by our quiet sufferings to awaken the conscience of the evil-doer and it is bound to awaken if our sacrifice is pure.

In 1942 Mahatma Gandhi began an individual struggle and the very first to be offered at the altar was Sjt Vinoba Bhave, an unassuming person, absolutely unknown to the world but in so far as his purity is con-

cerned he is unsurpassed by the tallest of Mahatma Gandhi's co-workers.

We need not fear that by the foremost leaders being the first to go to prison the people will become leaderless. We must do our duty and leave the rest in the hands of God, with an indomitable faith in Him.

We have not to think of how the struggle can be started. The Government has made that quite easy for us by its Apartheid policy. The Group Areas Act is Apartheid in its larger form. There is Apartheid in buses, in public thoroughfares, such as entrances at the railway stations, railway bridges, Municipal libraries and various other places where one can violate the law without in the least coming into

clash with the European public.

Because the Government is not arresting Mr. Manilal Gandhi, it does not necessarily mean that it will not arrest others. There must be a never ending stream of Passive Resisters to offer themselves to the Government.

If we are not prepared for this then we would humbly suggest that we are not at all sincere and all our talk about a mass campaign is meaningless and is wrought with danger beyond our control.

These views are offered in all humility and sincerity for the serious consideration of the sponsors of the plan of mass action against the unjust and immoral laws of the Government.

NOTES

Nationalist Party Youth Movement

THE Nasionale Jeugbond (Youth movement of the Nationalist Party) has again sent pamphlets to matriculants in Transvaal schools exhorting them to "hold the name of our volk high in the examinationroom." With the pamphlet is a card signed "With republican greetings, C. L. van der Merwe, organizing secretary." Among the objects of the Jeugbond listed are the making of every Jeugbonder a torch bearer of Nationalism; training a corps of members in the art of fighting elections and the making of that corps available to the Nationalist party, and to fight for apartheid and a republic divorced from the British crown. "The Nasionale Jeugbond is a school for the political leaders of the future," adds the pamphlet, which puts these questions to the recipient: "Do you realize that the Boervolk in South Africa is

again threatened by enemies in side and outside the Union? Are you willing to be a spectator of the fight between your volk and its enemies, or will you roll up your sleeves and join the rest of young South Africa already organized in the Nasionale Jeugbond?" A copy of the pamphlet was sent to 'The Star' by a matriculation student in the platteland. "We, as children of the United Party," he says in his covering letter, "protest strongly against such propaganda. Let us fight the Nazi ideals of the Nationalists. Long live the United Party."

We have the Suppression of Communism Act. Isn't there need for an Act for the suppression of this movement which is by no means better than Communism? It can be called worse since Communism at least claims to be working for democratic rights and for all which appeals to the common man.

U.N.O. Calls On South Africa To Suspend Areas Act

The United Nations Organisation General Assembly called for the establishment of a three-man commission to help South Africa, the Indian Republic and Pakistan settle their differences over the treatment of people of Indian origin in the Union. The resolution, passed on from the special (Ad Hoc) Political Committee was finally approved by 44 votes to nil, with 14 abstentions. South Africa was absent from the session. The resolution calls on the South African Government to suspend enforcement of the Group Areas Act and states that the item is to be placed on the agenda of the next Assembly session. The Indian delegate, Mr. R. K. Nehru, complained to the United Nations General Assembly that South Africa would not discuss the removal of disabilities on Indians except on the basis of repatriation — "their bodily removal." The resolution stated that the Commission would be composed of one member nominated by South Africa and one nominated by the Indian Republic and Pakistan together. The third member would be nominated by the first two nominees. The members would be appointed within 60 days, but in the event of default, the Secretary General of the United Nations Organisation, would lend his assistance to the Governments concerned "with a view to facilitating appropriate negotiations between them." The resolution also allows the Secretary General to appoint an individual to give such aid. Sir Keith Officer, of Australia, said he did not consider the General Assembly competent to intervene in such a domestic matter. His country would abstain from voting. The 14 countries which abstained from voting on the resolution were: Argentine, Australia, Belgium, Canada, Denmark, France, Greece, Luxemburg, the Netherlands, New Zealand, Sweden, Britain, Turkey and Venezuela. South Africa and Colombia were absent—(Sapa Reuter.)

African Pleads For Unity

An appeal for hand-in-hand co-operation between the White and Black races of South Africa and a condemnation of the ever-widening gulf between the races, were made at the South African Locations Advisory Board Congress in Durban by the President of the Congress, Mr. S. P. Sesedi. "The ever-widening gulf between the White and Black races," he said, "should not, to my mind, be allowed to continue. White and

Black races have together built up South Africa; they have co-operated in bringing the country we all love to her present state and development. Let the leaders on both sides of the colour line make a determined effort to live together in peace and harmony. "The African people of the Union have shown in the past 300 years of the White man's rule a remarkable spirit of tolerance and self-sacrifice, unsurpassed anywhere in the world. Beset on every hand by impediments, frustration and artificial handicaps, they have been tolerant until it hurt." The towns and cities of South Africa, he said, were, according to the new policy of the Government, to become the "White men's kraals" and the Native reserves

the natural homes or kraals of the Black people. "I disagree with this policy entirely as being illogical and impracticable," he said. Mr. Sesedi said that he regarded the proposed Urban Bantu Authorities Bill of 1952 to be of great significance. . . . "I view this draft Urban Bantu Authorities Bill of 1952 as a skeleton for discussion and say that its provisions will have to be more clearly and adequately defined before it can be accepted by this Congress as a practical measure," he said.

Racialism Increasing In Southern Rhodesia

It was apparent that racial tension was increasing in Southern Rhodesia and other neighbouring territories, and that too much

emphasis had been placed by many Africans on developments on the Gold Coast, said the Rev. P. Ibbotson, organising secretary of the Federation of African Welfare Societies, at the Methodist synod in Salisbury. There was no intention in Southern Rhodesia, he added, to hand over the Government of the country to Africans at any time in the future. The multi racial society of the country demanded a progressive policy of partnership. Africans themselves were at present complicating the situation, and were showing un readiness to make the contribution they were expected to make. Africans must learn and be willing to be guided. Europeans must fulfil the responsibility of privilege.—(S.A.P.A.)

RACE GROUPING COULD HAVE INDIAN SUPPORT

SEVERAL influential Indian residents in Maritzburg have predicted that as long as permanency is guaranteed the majority of the City's Indians will be prepared to make a complete move to a new group area beyond Plessislaer.

This area is the basis of a scheme drawn up by Dr. J. G. M. Richter for the future settlement of Indians in Maritzburg under the Group Areas Act.

Dr. Richter drew up his plan to support recent opposition from the residents of Mountain Rise to any Corporation plan that would allow for Indian expansion in that area.

Giving this information to me on January 13 Mr. E. C. Long, secretary of the Mountain Rise Ratepayers' Association, said: "Several influential Indians have told us that Indians will co-operate. They even said they would be prepared to shut up their shops in Church Street if we would transfer their licences."

Mr. Long said that Dr. Richter had formulated a scheme and had approached the Association for support. His scheme envisaged putting all Maritzburg's Indians over towards Plessislaer on municipal-owned land on the left-hand side of the railway line.

"There is an area big enough to build a town as large as Maritzburg and capable of accommodating 200,000 Indians," he said.

"First of all I was dubious about the idea, but on Saturday Dr. Richter took three members of the Committee and myself to see this ground. I can now say that his scheme is a most excellent one, and the only solution for Maritzburg's problem."

Mr. Long said that the big feature about Dr. Richter's scheme was that it looked into the future—at least 50 years ahead,

If his scheme was not adopted Maritzburg would become a long, narrow city, with extensions for Europeans beyond Scottsville and M'kondeni. It would be an ugly, straggling town. We will put forward the scheme ourselves if the Municipality will not co-operate," said Mr. Long.

The Association, however, wanted the co-operation of other ratepayers, for the problem was not only one which affected Mountain Rise.

"The Corporation say they have no money to develop beyond Plessislaer. If this is the case they have no money to develop Mountain Rise or any other place," he said.

The Association intends contacting other ratepayers' bodies in the city, but will not hold another public meeting until their annual meeting in March. The Committee will continue to support Dr. Richter's scheme and will urge its adoption.

| SWEETMEATS | | |
|--|-----------|---------|
| Pure | Wholesome | Healthy |
| ★ APPETISING— | | |
| ★ DISTINCTIVENESS of Flavour. | | |
| ★ Combined with INGREDIENTS of the PUREST QUALITY go into the making of our SWEETMEATS. | | |
| ★ Made by our experts whose knowledge and experience of the delicate art of preparing these Oriental DELICACIES. | | |
| ★ Assure YOU of the most PALATABLE SWEETMEATS money can buy any where in SOUTH AFRICA. | | |
| <div style="border: 1px solid black; padding: 5px;"> <p>અમે હૈક ભાતરી મીઠાઈઓ ભાવતીએ હાએ બહાર ગામના ઓડરોને સંભાળતી તમીરેદ્ધ ધ્યાન આપતીએ હાએ.</p> </div> | | |
| ★ Great care is exercised in the PACKING and DISPATCHING of country and foreign orders. | | |
| ★ WE assure you of PROMPT, HYGENIC SERVICE with the GUARANTEE of SATISFACTION. | | |
| We specialise in: | | |
| Birthday Cakes, Wedding Cakes, High Class Fruit Cakes, Pastries, and Naan etc. | | |
| —By— | | |



(Cnr: Grey & Victoria Streets.)
Phone 24965. — DURBAN.

NATURE CURE GUIDANCE

By Robert Lawrence McKibbin

Corporate Member Of The Institute Of Natural Therapeutics And Hypnosis (S.A.)
Hon. Secretary-Treasurer: Homoeopathic Society of South Africa.

[The following is of a series of articles on Nature Cure, written by Mr. Robert Lawrence McKibbin, 40 (a), Commissioner Street, Johannesburg. Mr. McKibbin will be pleased to answer through these columns any questions the reader may wish to ask.—Ed. I.O.]

WORM TROUBLE

4. HOOKWORM

Continued From Last Week

HOOKWORM disease is an affliction that is very common in conditions of poverty, malnutrition and lack of sanitation. Thus we find it in places like India, tropical Africa, the southern parts of the United States and many other places where there are many poor people living under unhygienic conditions and poverty in a warm and damp climates. It consists in infestation with large numbers of a small worm with a peculiar hook on it by which it anchors itself to the bowels, where it drains the vitality of the patient and at the same time produces a substance that breaks down the blood and causes severe anaemia. Haemorrhage is also a common complication of hookworm disease.

People who work with bare feet and hands in mud, mines, dams, tunnels and so on, where the soil is contaminated with the eggs of the hookworm, are most liable to infection. So also are workers on tea estates, coffee plantations and sugar-cane fields, as well as people who produce handle and sell vegetables.

The eggs of hookworms pass out from the bowels and are then distributed on the soil, where they lie until someone with bare feet or bare hands comes along. When the bare skin is brought into contact with the larvae of hookworms, these larvae stick to it and bore through the skin until they get into the blood-stream. Once in the blood-stream, they eventually get carried to the lungs, where they again bore their way out, get into the air-passages and up to the throat, where they are swallowed, thus ending up in the bowels where they attach themselves to the wall of the bowl and start producing their blood-destroying substances. Sometimes hookworms stay in the stomach or even the breathing-passages.

We can see, therefore, that people infected with hookworm are very likely to have severe fits of coughing. This would be caused by the irritation of the worms travelling from the blood into the lung and thence into the breathing passages and the throat. It is also easily understandable why the disease is so much more prevalent among the very poor and dirty element of the population who often go barefoot in soil that has been contaminated and who are very careless in their

habits and also suffer from lack of sufficient good food.

People with hookworm infestation may not realise what is the matter with themselves. The worms sap their vitality and poison the system and thus weaken the whole constitution, thereby making it liable to collapse under the strain of any illness such as malaria or dysentery or other diseases such as are common in warm climates where hookworm flourishes. When the diet is poor and insufficient and the habits of the people not up to proper standards of hygiene, hookworm disease gets a terrible grip on the population and is the cause of much suffering and sickness.

Sufferers from hookworm disease are especially apt to be very lazy, stupid and sickly. Their minds are dull; they have no energy, no liveliness and no ambition; and they have no resistance against disease. The complaint is very likely to be marked by bouts of feverishness, stomach troubles, such as heartburn, pains and indigestion, as well as constipation alternating with diarrhoea. Owing, as said before, to hookworms producing a substance that breaks down the blood, there is severe anaemia, which may even affect the heart and sight and give rise to dropsy. Usually there is much wasting of the tissues so that patients are excessively thin—bags of skin and bone.

Death can be caused by the infection, but usually the person is so reduced in vitality and resistance that some other disease comes along and carries him off easily.

It should be noted particularly that insufficient or wrong food very greatly increase the liability to hookworm infection.

Cure is effected by the use of Thymol or Carbon-tetrachloride in physiological dose, which means that treatment, for legal reasons, must be carried out by an allopathic doctor. Thereafter, great care must be taken to prevent re-infection, and the constitution requires to be built up by plenty of good food and other Nature Cure measures.

Prevention Of Worm Infestation

In the case of all worm troubles, prevention is indeed better than cure. People, especially those living in country districts or in crowded poor areas in towns, cannot be too careful, too particular to be clean and hygienic. Filth and dirty habits must be avoided at all costs.

Before touching any food, see that the hands have been washed thoroughly in clean running water. The hand should also always be washed after going to the latrine. Take the greatest care of the drinking water and ensure that it is absolutely pure and clean and free from contamination. A great deal of worm infection of all sorts originates in drinking water that has been contaminated. So often drinking water is carelessly drawn from shallow wells, fountains and other sources that have no protection whatsoever from being contaminated by rain or storm water, animals' droppings, and even by seepage from nearby latrines. Infection can so easily result from such conditions.

All food must be handled with clean hands and should be washed off carefully several times in clean water. This is especially the case with food that has been grown with nightsoil or animal dung. Take no risks in this connection.

Never let animals, such as dogs and cats, lick the skin, hands or faces of people. Any amount of

infection is picked up from pets. Do not let children hug or kiss or sleep with dogs and cats. Never go barefoot around pigstyes or other places where worm eggs may exist. Avoid also letting the soil of such places touch the bare skin.

Never eat raw meat, underdone meat or meat from an animal that has had "measles." And, of course, it is simply inviting trouble to eat meat that has not been carefully inspected by a competent health inspector.

Dispose of all nightsoil hygienically and especially so in the case of the motions of people known to have worms of any sort.

Never let people spit promiscuously where others have to walk about.

Forbid people to have motions in the open veld; or if one is taken short and cannot manage otherwise, then the motion should be passed in a shallow trench dug in the ground and afterwards this should be well covered with earth.

Maintain a high standard of general health by eating plenty of good, sound, fresh health-giving foods, especially fresh raw salads, root vegetables and fresh fruits, also dried fruits; and avoid all "worm food" such as sweets, cakes, white bread, *roti* and so on. Remember that a good, sound, healthy body has a high resistance to worm infection. Parasites and pests are only Nature's instruments for removing the unfit and those who will not conform to her rules of commonsense to keep sound health. Those who do obey her and who follow her fundamental rules will receive her protection and help at all times.

P.O. Box 96,

Phone 24171.

To Furnish Your Home Economically

See

LALA BABHAI & CO. (PTY.) LTD.

107 Prince Edward Street, DURBAN.

Stockists of:—

NEW & RECONDITIONED FURNITURE & HOUSEHOLD EFFECTS, RADIOS & RADIOGRAMS, MUSICAL INSTRUMENTS, SEWING MACHINES & OFFICE FURNITURE Etc.

Exporters and Commission Agents for Natal Fruit and Vegetables. We specialize in green ginger and Indian Vegetables. Wholesale only. Write for particulars
Box 96, Durban.

MY JUNGLE BABIES

By EDITH BIERSTEIN

A Danish nurse worked with the Red Cross in Greece, Hungary and Germany—and then found new adventure in India as a public health nurse with the United Nations World Health Organisation. In this article, sent from the jungle, she tells of babies in danger—and how they are saved.

I COULD not help laughing, there in the mud and bamboo hut deep in a southern Indian jungle, trying to clean myself and my uniform. My Indian nursing understudy stared at me in astonishment.

We had toiled through the long, hot night hours to save a young mother and her first baby. Now we had some miles to walk through the unfriendly bush, lighted only by the flickering torch of a guide, to the nearest bullock track where we had left our jeep. But my laughter was at the remembrance of my familiar and comfortable pattern of life when I decided to embark on a career as an international public nurse.

I saw myself, another Florence Nightingale, going from bed to bed, gently giving tablets of the new anti-malarial drugs and leaving peacefully sleeping patients in my wake. Two months later I was being jolted in a primitive bullock-cart through an endless corridor of rank elephant grass, the perspiration streaming from under my topee, and the crisp white uniform I had donned in the morning a sodden, dust-stained, shapeless mass!

As we reached the first village, women and naked children ran screaming into the undergrowth as though from a hundred devils. They had never in their lives seen a white woman and our first visit was to show ourselves and perhaps build up trust in our good intentions.

For this was Terai swamp country, breeding ground of the anopheles mosquito which transmits the malaria parasite with its bite and with it one of the greatest destroying diseases of the human race. Gradually, as we gained the confidence of the people and entered the cool, low mudhuts with their roofs of woven banana leaves, the news spread that we did not harm the children but had some wonderful pills to treat the fever and the terrible ensuing headaches.

In one isolated settlement we were the first visitors for twenty-six years and there were many villages where nobody had heard about a world war or even about Mahatma Gandhi. It was small wonder if, in a few cases, we heard that the treatment hadn't helped.

Our patients had pulverised the pills and smeared them on their foreheads, as they do with holy ash from the temples. Yet slowly we became friends with the shy, backward but kindly people of these isolated hill-tribes. DDT was sprayed in houses and huts, the great number of malaria cases diminished and public health nurses changed the whole area.

All this was in the undeveloped forests of the United Provinces, in northern India. Now,



as I write in the admittedly less backward regions of southern Mysore, even the nearest doctor may be thirty miles away. There are many diseases, from rheumatic fever—due to the humidity—by way of cholera, typhoid, plague and the various deficiency illnesses, result of the poorly varied diet. The crying need for medical aid, for knowledge about the why and how of personal hygiene, clean houses and proper food meet the two Indian nurse understudies and I wherever we go.

In the field, not a minute is wasted. All villages in our area are visited once and thereafter a selected group of villages is toured weekly. Visits are paid and treatment given in thousands of homes. Whenever a group is gathered anywhere, health education begins—and that means nearly everywhere every day.

Most people imagined malaria to be due to a devil or else too much rain. To help the lessons we use a poster showing an en-

larged mosquito. The villagers find this difficult to identify and laugh uproariously when told what it is. "Perhaps they are so big in your country," one headman said, "but in our country they are only very small."

If the children are dirty we take the opportunity—with illustrative washing!—to explain again and again that you keep healthy more easily if you keep clean. It is quite a job to teach children as well as adults that a clean bandage is better than limbs mixed with crude sugar, or than oil and charcoal, cowdung or railway oil!

One day a boy of nine asked for something to cure his headache. Wondering whether he had fever and removing his cap, I found a stone-hard 'golf ball' fixed to his head. His brother

At a baby show, to our delight, five of the prize-winners were from our mother-and-child clinic. The children of wealthy parents are easily recognised with their beautiful silk dresses, earrings and chains of silver or gold around neck or hips. Girls of 4 or 5 sometimes have holes pierced in the nose, held to begin with by a tiny piece of bamboo but soon replaced with twinkling diamonds.

During the cold season children often wear a wollen sweater and woollen cap but very seldom pants. The head, it seems, is the most important part to keep warm!

And it's almost impossible to say whom we love most, babies toddlers or school children. Driving through Sargar our 2 to 8 year olds will always salute us in funny ways. A little one near the bungalow considers he must greet us in a new way every time we meet. Once we found him standing on one foot with the other foot to his head, shouting "Good morning" with a sweet accent.

In the eight village schools we meet about 445 students once a week, and they form the richest soil. The girls bring us flowers to put in our hair and the boys lemon, cucumber or betel nuts. So simple a thing as washing the hands and cleaning the nails is fun to them. On the first occasion it did not occur to me that they themselves could make a nail-cleaner of bamboo and, with only one pair of scissors, we had a long queue of children singing an African cannibal song.

I was afraid we might hurt the children's feelings with our cleanliness parades, but they laugh at one another and are cleaner next time. Though ages are from 7 to 15, not infrequently a big girl brings her baby sister or brother, whom she is to look after while her parents are at work in the fields. Moreover, we can always count on adults to swell the audience, particularly the old men, too old to work but not too old to learn.

They really take an active part in the lesson, loudly expressing their surprise, approval or joy—and they often answer questions meant for the students.

Again in the Untouchables' colony, we also do home visiting, act as sanitary inspectors and persuade the householders to clean the surroundings, dig refuse pits, burn what can be burned and form a kitchen garden with fencing. An uncooperative house owner is warned that if he doesn't do as we advise, we will do it. And

having accidentally hit him with an axe, inflicting a deep gash, an old woman made the ball of lime and sugar. Removing it apparently needed another axe!

After trying a shampoo in vain, we experimented with forceps and scissors but it was an hour before the infected wound was free, soothed with penicillin ointment and properly bandaged. By our next weekly visit, the boy had entirely recovered.

The Indian children are lovely. But one baby was given to me to examine with the complaint that he was crying night and day. He was covered in rags and terribly dirty and I gave him a good bath with medicated soap. In the sun, on a very hot day, there was no risk of catching cold.

Next week, we found a happy mother with a beautifully clean and healthy child which she gave into my arms, saying, "This is your baby now—you are our mother!" This is one of the sweet ways of expressing gratitude.

when we nurses together with the big boys of the colony clean up, the fact that women and children should do his work is such a keenly felt disgrace that subsequently his place is always clean.

The boys are especially clever and interested. They clean the clinic floor, bring water, keep order in the crowd and help pack our supplies when the work is done. Then they jump into the jeep to have the exciting trip to the bungalow they have dreamed about all week.

And the results of our intrinsic work of malaria control demonstration? "Hundreds of labourers have been taught the DDT spraying technique and each house sprayed in an area of 1,600 square miles. Thousands of mosquitoes have been caught, dissected and examined for malaria infection. Also, thousands of rats have been caught, combed and the insects

found on their bodies examined for plague-infection to see the result of DDT spraying. Not one case of plague has appeared in our area since the first DDT sprays two years ago.

In the schools the results can easily be seen, but in all the villages the team is now well-known. Our two jeeps are welcomed by cheering crowds. One group will watch the big, beloved doctor while he examines people; another group will follow the young insect collectors with their tubes to the dark corners of a house or to the river. Still another crowd clusters to see what we nurses are doing in the midwives' house or in the school.

In health education, as in a garden, we have to wait before the seed can flower. We are here only for a time and our hope is that one day the children themselves will gather the fruit.—I, N.P.R.A.

diploma. "I believe all the lack in ourselves can be resolved by this Movement."—N.U.N.A.

The Hospital Welfare Society

The Provincial Administration have taken over the Moslem Kitchens at the Somerset Hospital and the Groot Sohnur Hospital on December the 1st, and the Hospital Welfare Society (Muallim) which started the kitchens about ten years ago is no longer responsible for the salaries of the staffs in the kitchens. The Hospital Welfare Society started the kitchens with the purpose of ensuring that Moslem patients are given food that has been prepared according to Islamic rites. The Society paid the wages of a kitchen staff of four at the Groot Sohnur Hospital and a staff of two at the Somerset Hospital. From December 1 the Society continued to act in an advisory capacity in connection with the kitchens. The work of distributing comforts among the Non-European patients at Peninsula Hospitals will continue as well as among the inmates at various institutions. The Society also maintains the services of two priests. One gives Moslem boys religious instructions at the Porter reformatory. The other Priest visits regularly the Somerset, Groot Sohnur and Brooklyn Hospitals. Also visits the foreign Moslem Seamen, who are usually admitted in the Somerset Hospital. Funds accumulated by the Society will be diverted to other welfare work which will be undertaken in the near future. At present the Society has no collecting list out.

Hindi Examination Results

The following are the results of the Hindi Examinations conducted by the Rashtia Bhashar Prachar Samiti, Wardha, India in September, 1952: Durban Centre: Parohaya (std. VII) Third Class: Baboo Balgobin, Dabipersadh Prabha, Jainarain Manien, Ramprasad Despnarain.

Prarambhika (std. IV), Second Class: Bhugwandin Mabaand, Badhal Harisohandra, Durga Somaroo, Luckon Indrapersadh Sarpoo, Sukhrasj.

Third Class: Bhugwandas Benilall, Ramilall Brijlall, Sharma Shrikrisheh Baboolall, Sharma Harikrishen Baboolall, Sukhdeo Kishenpersadh.

Pietermaritzburg Centre: Pravesh (std. IV), Second Class: Gandhij Savitri, Bhola Bharath.

Third Class: Bandha Sundri, Harkoo Bharath, Harkoo Harilal, Harkoo Dhankumari, Harkoo Shviakumari, Shivaprasadh Vidyaawati, Shivaratan Dineshchandra, Soogam Tara Devi, Sukhrasj Indrajith.

Chaka's Kraal Government Aided Indian School

Chaka's Kraal Government Aided Indian School staged two plays just before Christmas holidays. They were "Abdulla's Ghost," an Arabian Sketch and Kalidas's immortal epic, "Sakuntala." The latter was staged in English for the first time in South Africa by little children about thirteen years of age. The grautee of the school Mr. S. Roopsingh wishes through these columns to congratulate the Principal, the Staff and the pupils of the School on their praiseworthy achievement. Since the appointment of Mr. T. Vadivalu as principal, he says, the new principal has been responsible for much hard work in and out of school for the progress of education in Chaka's Kraal. Notwithstanding his hands being full with other work connected with the school Mr. Vadivalu took on his shoulders the almost impossible task of preparing children to perform "Sakuntala" and it was performed with unprecedented success for which due credit goes also to the young and energetic teachers whose zeal and sacrificing spirit helped a great deal towards the success of the play.

HINDU DHARMA

By—M. K. Gandhi

Price 10/-

To be had from:

'INDIAN OPINION,'
P Bag, Phoenix, Natal.

Citicura

ANTISEPTIC OINTMENT

FOR SAFETY'S SAKE

A break in the skin is a 'way in' for germs! Apply Citicura Ointment—quickly. To rapidly restore skin health. To combat infection. To allay soreness, and to keep the injury clean and comfortable while it heals.

FOR CUTS AND SCRATCHES

53

Things In General

Foundation Bursars

The twelve Foundation bursars at the Jan H. Hofmeyr School of Social Work who received financial assistance during 1951, have all received their diplomas. In sending their final reports the Director of the school, Dr. Ray Phillips says:—"I cannot let this opportunity pass without expressing again the very great appreciation of the School Committee for the generous and cordial co-operation of the foundation in making these bursary grants available to young Africans for service to their people." All twelve students have now found useful employment. George Ohimonyo has gone to the Foundation's own project at Lamontville, Durban. Vivian Milite is also doing social work in Durban under the Native Affairs Department. An Indian student, Mr. A. K. Naidu, has joined the F.O.S.A. staff in the same area. Child Welfare Societies have been glad to absorb these trained workers. Miss Chetty has gone to the Indian Child Welfare Society in Pietermaritzburg. Miss Matselo to Port Elizabeth and Miss Meeli to Kimberley. Four Bantu students have found interesting and valuable appointments with the National Building Research Institute, where they are helping with an investigation into Native Housing requirements. Sydney Matsihqi has joined the Cape Town City Council staff, Native Administration Department, and Simon Thomas is remaining in Joban-

burg to work for Coloured and Indian Blind. Samuel Matsenyana goes to the National Veld Trust and will work in the Ciegoi.

Moral Re-Armament

The Egyptian Minister for Foreign Affairs, His Excellency Dr. Salah El Din Pasha told the New Year Moral Re-Armament Assembly at Caux, Switzerland, that the United Nations would be able to unite at Caux. "All the difficulties that puzzle the statesmen of the world in Paris would find adequate and agreeable solution here." "There is no difficulty which would not find a solution here on the basis of human consideration," he told the 650 delegates from thirty nations. "You face difficulties in a practical way here because you approach them on a human basis. The principles of Moral Re-Armament are based on accepted principles of good character on which all religions of the world agree. The religion of Islam is based on them. None can refuse to join." The Foreign Minister appealed to Dr. Buchman to help the statesman of the world and himself settle their differences. "I believe the principles and ideas of this Movement can also help us solve our internal difficulties and I will do all I can to make them known and applied. The peace of the world depends on peace inside each one of us and each of us must begin with himself. We in Egypt need a great deal of unity and dis-

MAHARAJ SINGH STRESSES STUDENTS' NEED OF ETHICAL AND SOCIAL DISCIPLINE

Raja Maharaj Singh Governor of Bombay, has emphasised the need for having Hindi as the medium of instruction in the higher and secondary stages of education. But at the same time, he said, it was both necessary and desirable to retain English as one of the compulsory subjects in the curriculum in secondary schools and colleges. "No odium, he said should be attached to English as a foreign language. "The wealth of the world's learning in diverse subjects is

enshrined in this international language, and unless one knows English well, one will not hold the key to this rich store house." Raja Maharaj Singh, who was addressing and annual convocation of Patna University recently emphasised the need for intellectual, ethical and social discipline and said that the universities ought to be model institutions in which discipline was maintained both in the class rooms and outside. "From time to time," he said, "one reads with regret of the misdirected



enthusiasm and outbursts which take place in schools and colleges and even in universities. The perpetrators forget that strikes and such like manifestations of displeasure are double-edged weapons. When, in later life, former strikers hold responsible posts as teachers, executive officers in Government service or commercial and industrial houses, how will they be able to prevent strikes and reason with strikers?" "But," the Governor said, "we must not confine our censure to refractory students. In such matters the teaching staff of educational institutions have a valuable part to play. I have




noticed with dismay that in time of stress when teachers should be united in the cause of discipline, some, though fortunately not a majority, are secretly or openly supporters of indiscipline. I am glad to think that the great majority of our students are well-behaved and amenable to advice."

Sets Of Indian Art Pictures
By Celebrated Indian Artists
 Price 8.- including postage.
 'INDIAN OPINION,'
 P/Bag, Phoenix, Natal.

MYSTERY COMIC SERIAL

LESLEY SHANE





INPRA all rights reserved

The End.

Don't miss next weeks brand new serial—"They Made Her A Star."

Save Money On FURNITURE

SPECIAL WHOLESALE DEPARTMENT TO CATER FOR STOREKEEPERS

Write for Price Lists and Illustrations of Factory-made Furniture:

Bedroom Suites, Diningroom Suites, Lounge Suites, Office Furniture, Kitchen Furniture and Occasional Furniture

You can also send Customers to our Showrooms to be served on your behalf or sell to them from our Catalogue which we can supply on application.

SIMPLEX FURNITURE FACTORY (PTY.) LTD.,

64 Alice Street, DURBAN.

OUR INDIA LETTER

(FROM OUR OWN CORRESPONDENT)

Shri Nehru On Kashmir And Minorities In Pakistan

Prime Minister Shri Nehru said in Calcutta on January 1 that India would keep her pledge to hope a plebiscite in Kashmir to determine the will of people there. Even if the United Nations had not been there India would have done the same. Kashmir was neither Pakistan's nor India's; it was Kashmir's own. They shall determine her future. According to P.T.I. Shri Nehru emphasised that Indian troops were sent to Kashmir to protect her from invasion. "They wanted to keep friendly relations with India and we agreed gladly: if they ask us to leave now we will leave tomorrow." Shri Nehru said that India did not want to go to war with Pakistan. "But if Pakistan by mistake invades Kashmir we will not only meet them in Kashmir but it

will be a full scale war. Referring to conditions of minorities in East Pakistan Shri Nehru observed that they felt very much if any inhuman treatment was meted out to Hindus in East Pakistan as they did when people of Indian origin were maltreated in South Africa. "But we are determined not to go to war with Pakistan on any question."

Shri Nehru Advises Scientists

The 39th session of the Indian Science Congress began in Calcutta on January 2. About 400 delegates from India and a number of foreign scientists are attending the session which was inaugurated by the West Bengal Chief Minister Dr. B. C. Roy. Addressing the Congress Prime Minister Shri Nehru said that scientists throughout the world should consider the problem of bridging the gulf between technological progress and study

of man. He felt science had great field to develop. The study of man had not kept pace with the study of other things. He did not know where the former would catch up the latter. He said that in the world today a great deal was happening which was not exactly admirable. On one hand the world's capacity to progress in some directions was tremendous and on the other there were preparations for a large scale destruction. Shri Nehru added, "One of India's achievements during the past four years in setting up of national laboratories all over the country. I think we can take legitimate pride in them, showing as they do the development of India in regard to science. In any future progress it is quite essential that we should look to these foundations which will undoubtedly produce result of great national importance."

Naresb Kumar has been ranked India's number one tennis player in rankings announced by the All India Lawn Tennis Association. Narindra Nath has

number two, G. Vasant. Number three, Vishan Mohan number four and B. R. Kapinspathy number five. Dillip Bose and Somant Misra who were number one and two last year were not placed in this year ranking on account of insufficient playing.

The India Government have decided to reduce with immediate effect the rate of import duty on Copra from 37½ per cent *ad valorem* to 25 per cent *ad valorem* where the standard rate of duty is leviable and from 25 per cent *ad valorem* to 25 per cent *ad valorem* if Copra is produce manufacture of British Colony.

SHAVING COSTS LESS
— With —
MINORA BLADES
4 Blades For 6d.

R. VITHAL
Bookkeeper, Writing up Sets of
Books, Balance Sheets, Income
Tax Returns. Apply:
306 Commissioner St.
Jeppe, Johannesburg.

Stocked by all good Tailors

Albein Serges

and

Beintex Suitings

TRADE ENQUIRIES ONLY

BEINASHOWITZ BROS.

WHOLESALE WOOLLEN MERCHANTS

333 Pine Street,

DURBAN.

Box 2689.

Tel. Add.: "SUITINGS."

Phones: 20063 & 63512.

Pilgrims!

JOURNEY TO
MECCA

by comfortable 2 or 4-engined aircraft

- Save up to 40% on scheduled air fares.
- Reduced rates for large parties or whole plane charters.
- Payment accepted on the lay/by system — Save while you wait.
- Re-entry visas arranged before you leave.

Full details from

AIR EXCURSIONS AND CHARTERS

314/5 Service House, Anderson Street, (near Harrison Street) Johannesburg
Phone: 22-2342

Phone Day 24169 Phone Night 833549

L. RAJKOOMAR (PTY.) LTD.
14, CROSS STREET, DURBAN.

Funeral Directors and Manufacturers of all classes of Coffins and Wreaths

Contractors to the INTERNATIONAL FUNERAL COMPANY, LIMITED.

Reg. Office: 14 CROSS STREET, DURBAN

Country Orders for Coffins and Wreaths, accepted by phone and despatched by rail at the shortest no.ice.

The Epic Fast

(BY PYARELAL)

An account of Mahatma Gandhi's Fast in September 1932, and events leading up to the Yeravda Pact with all relevant documents.

320 Pages. Price: 2s. 6d.

Obtainable From:

"Indian Opinion"

Phoenix, Natal.

वेद्यवार्ता पुस्तके

| | |
|-------------------------------|------|
| शान्तमार्ग (संघी युवनी नेवेक) | 4 0 |
| शान् सन्धारी (युवकी) | 10 1 |
| अथवाता वाथर | 4 1 |
| अथवाथराना दिवा | 4 0 |
| शान्तमार्गाना सुक | 4 0 |
| शेडीनी | 4 0 |
| अथवा अथ | 4 0 |

C/O INDIAN OPINION, P. Bag, Phoenix, Natal.

BOOKS FOR SALE

| | | |
|--|----|---|
| NON-VIOLENCE IN PEACE AND WAR Vol. II.—M. K. Gandhi | 12 | 6 |
| THE GITA ACCORDING TO GANDHI —Mahadev Desai | 12 | 0 |
| GANDHIANA—D. G. Deshpande—(A Bibliography of Gandhian Literature) | 5 | 0 |
| WOMEN AND SOCIAL INJUSTICE—M. K. Gandhi | 10 | 0 |
| LPIGRIMAGE FOR PEACE—Pyarelal | 12 | 6 |
| STRAY GLIMPSES OF BAPU—Kaka Kalekar | 5 | 0 |
| SELECTED LETTERS—M. K. Gandhi (1st Series) | 1 | 9 |
| FROM YERVADA MANDIR—M. K. Gandhi | 1 | 6 |
| SELECTIONS FROM GANDHI—Nimar Kumar Bose | 10 | 0 |
| FOR PACIFISTS—M. K. Gandhi | 3 | 0 |
| DIET AND DIET REFORM—M. K. Gandhi | 5 | 0 |
| GLEANINGS—Mira | 1 | 6 |
| GANDHIAN ETHICS—Benoy Gopal Ray | 2 | 0 |
| BAPU—Marry F. Barr | 4 | 0 |
| MY LIFE AND MISSION—Vivekanand | 1 | 8 |
| COMMUNAL UNITY—M. K. Gandhi | 25 | 0 |
| FAMOUS PARSIS | 7 | 6 |
| FREEDOM AND CULTURE—S. Radhakrishnan | 3 | 6 |
| THE EPIO FAST—Pyarelal | 2 | 6 |
| THE HEART OF HINDUSTHAN—Radhakrishnan | 2 | 6 |
| TALES OF BENGAL—Santa and Sita Chatterji | 8 | 6 |
| CHAITANYA TO VIVEKANANDA | 3 | 3 |
| FOOD SHORTAGE—Gandhi | 4 | 0 |
| INDIA AND HER PEOPLE—Swami Abhedananda | 8 | 6 |
| POEMS—Ramdas | 1 | 7 |
| THE SCEPTRED FLUTE—Sarojini Naidu | 8 | 0 |
| STORY OF SATARA—Major B. D. Basu, (I.M.S.) | 15 | 0 |
| THE U.K.C.O AND INDIA—A. N. Agarwala | 5 | 6 |

Obtainable from:

'INDIAN OPINION'

P. Bag. Phoenix, Natal.

Books For Sale

Tagore's Literature

Essays, Novels, Poems and Plays

| | | |
|-------------------------------------|---|---|
| SACRIFICE (Novel) | 5 | 6 |
| GORA (Novel) | 9 | 0 |
| MASHI (Novel) | 5 | 0 |
| LOVER'S GIFT (Poems) | 3 | 6 |
| CHITRA (Play) | 3 | 6 |
| STRAY BIRDS (Short Poems) | 3 | 6 |
| RED OLENDERS (Play) | 4 | 0 |
| HUNGRY STONES AND OTHER STORIES | 5 | 6 |
| THE HOME AND THE WORLD (Essays) | 6 | 0 |
| GLIMPSES OF BENGAL (Essays) | 3 | 9 |
| REMINISCENCES | 5 | 6 |
| POEMS OF KABIR | 3 | 9 |
| POST OFFICE (Play) | 2 | 6 |
| THE KING OF THE DARK CHAMBER (Play) | 5 | 0 |

Obtainable from:

'Indian Opinion'

P. Bag, Phoenix,
Natal.

ઈન્ડિઅન ઓપિનિઅન

મહાત્મા ગાંધીજીના દસ્તે
શને ૧૯૦૩માં સ્થપાયું. ય

પુસ્તક ૫૦ મું-અંક ૨

શુક્રવાર તા. ૧૮ જાન્યુઆરી, ૧૯૫૨.

શુદ્ધ નકલ પેની. ૬

“ઈન્ડિઅન ઓપિનિઅન”

શુક્રવાર તા. ૧૮ જાન્યુઆરી, ૧૯૫૨

વ્યક્તિગત લડત

જો અઠવાડિયે જલમક્ટીન કોન્ફરન્સ ઉપરના પોતાના લેખમાં શ્રી. મણીલાલ ગાંધી એ જણાવ્યું હતું કે સરકાર તરફથી થઈ રહેલા અન્યાયની સામે સામુદાયિક લડત ચલાવવાની હતી આપણી તર્ફવારી નથી અને તેથી સારામાં સારા માગે વ્યક્તિગત લડત ચલાવવાનો છે. જેઓ સરકારની સામે સત્યાગ્રહ ના શુદ્ધ સ્વચ્છ લડવા માગે છે અને જે બાળકમાં જેઓની સત્યનિષ્ઠા છે તેઓને આ વસ્તુ પર ગંભીર વિચાર કરવાની જરૂર છે. જે તેમ નથી કરવા ઇચ્છતા અને જેઓને સત્યનિષ્ઠા નથી તેઓ તેા પોતાની રીત મુજબ જ કામ કરશે અને અમે ફરીથી કહીશું કે તેઓ લાગતાવળગતા લોકોપર દુઃખ આણશે અને દેશમાં અધાધુધી ફેલાવશે. વ્યક્તિગત લડત સુચવવાનું કારણ એજ છે કે તેમ કરવાથી લડત તદન શુદ્ધ રહેવાની ખાતરી રહેશે, તેમાં એવાજ લોકો રાખી શકાશે કે જેઓપર લડતને ઠગો નહિ દેવાની આપણે ખાતરી રાખી શકીશું, તેઓ સત્યાગ્રહનો અર્થ સંપૂર્ણપણે સમજી શક્યા હશે તેવાજ અને તેના સિદ્ધાંતોને વળગી રહેનારા લોકોજ હશે. મત્યેક સત્યાગ્રહીપર દેખરેખ રાખી શકાશે અને તેની પાસેથી હિંસાળ લઇ શકાશે. સામુદાયિક લડત કર્યા વિના તે સફળ નહિ થઈ શકે એ તદન ભુલ ભરેલી માન્યતા છે. સત્યાગ્રહ હવેશાં ગુણબળ ઉપર જ આધાર રાખે છે સંખ્યા બળપર કદી નહિ. આપણી પાસે એકસો કે બસો કે પાંચસો સત્યાગ્રહીઓનું દળ

તથવાર હોવું જોઈએ. એ અશક્ય છે એમ એ કહેવામાં આવે તેા આપણે લડવાને તર્ફવારજ નથી એવું પુરવાર થાય છે. ૧૯૩૦માં મહાત્મા ગાંધીજી એ હાંદમાં ૮૦ સત્યાગ્રહીઓથી લડત ચાલુ કરી હતી. એ ૮૦ સત્યાગ્રહીઓ કસોટીમાંથી દરેક રીતે પસાર થઈ ચુકેલા હતા. તેમાંથી પછી આપો આપજ સામુદાયિક લડત થઈ ગઈ હતી. તેમ કરવાને લોકોની લાગણીઓ ઉરફેરનારાં બાધણુ કરવાની જરૂર નહોતી પડી. આપણે લોકોના હૃદયો હલાવવાની અને તેઓનું અંતઃકરણ જાગૃત કરવાની જરૂર છે. જે નેતાઓના આચરણથી આપોઆપ જાગૃત થશે. સત્યાગ્રહમાં આપણે હેતુ ભુજે કરનારને અડચણમાં મુકવા કે તેને રીબામણી કરવાનો હોવો નહિજ જોઈએ, કારણ જુએ કરનારને આપણે તિરસ્કારવા નહિ જોઈએ પરંતુ જુરી વસ્તુનો તિરસ્કાર કરવો જોઈએ અને તેથી તે વસ્તુને જુએ કરનારને ગમે તેવો ખોટું વહોરી લઈને પછુ નમવાની સાફ ના કહેવી જોઈએ, તેમ કરતાં જો જુએ કરનારને અડચણ થતી હોય અથવા તેને રીબામણી થતી હોય તેા આપણે લાચાર છીએ. આપણે તેા શાંતપણે દુઃખ ઉઠાવીને જુએ કરનારનું અંતઃકરણ હલાવવા ઇચ્છીએ છીએ. અને આપણું બલિદાન જો શુદ્ધ હશે તેા તેનું અંતઃકરણ જરૂર હલાવી શકીશુંજ.

૧૯૪૨માં મહાત્મા ગાંધીજી એ વ્યક્તિગત લડત ઉઠાવી હતી એન માટે શ્રી. વીનોબા ભાવેની

સૌથી પ્રથમ પ્રસંગી કરી હતી. તેઓ એક સાદા સરખ માણસ છે અને દુનીયામાં ભાગ્યેજ કોઈ તેમને ઝોળખતું હતું પરંતુ શુદ્ધતામાં મહાત્મા ગાંધીજીના કાર્યકર્તાઓમાં તેમને કોઈ પછુ આટી શકે તેમ નથી. આપણા અગ્રગણ્ય નેતાઓ સૌથી પ્રથમ કેદ થઈ જશે તેા કોમ નેતા વગરની થઈ પડશે એવો ડર રાખવાની આપણે જરાયે જરૂર નથી. આપણે તેા આપણી ફરજ આપણેા હર્મ બળવી બાકીનું ઇશ્વરના કામમાં સોંપી દેવું જોઈએ અને તેનામાં અચળ શ્રદ્ધ રાખવી જોઈએ. લડત કેવી રીતે ઉઠાવવી તેના વિચાર કરવા આપણે જરૂર રહેતીજ નથી. સરકારે એપાર્ટહેડની નીતીથી આપણે માટે એ સરળ કરી મુકયું છે. ૨૩૫ એરીયાઝ એક્ટ એ તેા એપાર્ટહેડનું સૌથી મોટું સ્વરૂપ છે. યાકી તેા બસોમાં એપાર્ટહેડ છે, જાહેર માર્ગો જવા કે રેલવે ના પુલો રેલવે સ્ટેશનમાં દાખલ થવાના માર્ગો, જાહેર માર્ગો, રમુનીસીપલ લાયબ્રેરીઓ વિગેરે અનેક સ્થળોએ એપાર્ટહેડ છે, જેના મુદ્દાપીઠન પ્રબંધની સાથે સંબંધમાં આંખા વિના આપણે ભાગ કરી શકીએ છીએ. સરકાર શ્રી. મણીલાલ ગાંધીને પકડતી નથી એથી બીજાઓને પછુ નહિ પકડે એમ માની લેવાની જરૂર નથી. સરકારને બલિદાન આપવા આપણી પાસે સત્યાગ્રહીઓને ચાલુ કરી દેવા જોઈએ. જો એટલી આપણી પાસે તર્ફવારી ન હોય તેા અમારે નમ્રપણે સુચવવું જોઈએ કે આપણામાં સત્યનિષ્ઠા નથી અને સામુદાયિક લડતની આપણી સઘળી વાતો અર્થ વગરની છે અને આપણાથી અંકુશ નહિ રાખી શકાય તેવાં જોખોથી ભરેલી છે.

આ વિચારો સરકારના અન્યાયી અને અનીતી ભરેલા કાયદાઓ સામે સામુદાયિક લડતની ચોજના રચનારાઓના ગંભીર ધ્યાનને માટે અમે નમ્ર પણુ અને સંપૂર્ણ સહબાવનાથી રજુ કરીએ છીએ.

નોંધ

હાંદીઓની નીતી પર મી. લોમ 'નાટાલ વિટનેસના' ખબર પત્રોને માઉન્ટન રોજી રેટ પેપર્સ એસોસીએશનના મંત્રી મી. ઇ. સી લોંગે મુલાકાતમાં જણાવ્યું હતું કે, મેરીટાઇમના નાણા ઉચ્ચ સ્થાન ધરાવતા હાંદીઓએ અને જણાવ્યું છે કે, ૨૩૫ એરીયાઝ કાયદાને લાગુ પાડવાના કામને તેઓ મદદ કે જે તેમના લાયસન્સ બીજા જમા માટે બદલી આપે તેા તેઓ ચર્ચ સ્ટીડમાં તેઓની દુકાનો છે તે બંધ કરી દેશે મેરીટાઇમની બહાર લેસ્ટીસ સ્ટેપર નામથી ઝોળખાતી જમાએ હાંદીઓને ખસેડવાનો વીચાર છે, વધુમાં મી. લોંગ જણાવે છે કે, આ જમા એટલી મોટી છે કે ત્યાં અહી ૨૦૦૦૦૦ હાંદીઓ આરામથી વસી શકશે.

સંખ માટે નેટીવાની અપીલ સાઉથ આફ્રીકા લોકસનસ એડવાઇઝરી બોર્ડની ટેલિગ્રાફ દ્વારા ડરબનમાં બરાહ હતી એ પ્રસંગે એના પ્રમુખ મી. એસ. પી સીસીએ જણાવ્યું હતું કે, ગોરાઓ અને બીન-ગોરાઓ સંખ સંખ વધુ અને વધુ બગડતો જાય છે. માંડે માનવું છે કે, આ પરીસ્થિતી અટકાવવાની ઘણી જરૂર છે. દક્ષિણ આફ્રીકાની ઉનનીમાં ગોરા અને બીન-ગોરાઓને હાય છે. બનેને કોમના નેતાઓએ શાંતીથી સાથે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહી ની આફ્રીકન પ્રબુ ઘણી શાંતીથી અને ભાગ્યથી ૩૦૦ વર્ષ સુધી ગોરા ઓના રાજ્ય નીચે રહ્યાં છે. અનેક નીરાશાઓ અપમાતો તેઓને સહન કરવા પડ્યા છે આને એ સહન શક્તીને કસોટી થાય છે. આજની સરકાર શહેરોને ગોરાઓ માટે અને ગામડાઓને કાળાઓ માટે કરવા ઇચ્છે છે, સરકારની આ નીતીને સામે માટે સખત વીરિય હું નોંધાવું છું

કુદરતી ઉપચારો

(લેખક : સી. રોબર્ટ લોરેન્સ ચેકરીબીન)

૧૪૦ (અ) કમીશનર સ્ટ્રોક, બેહાનીરામગંના મી. રોબર્ટ લોરેન્સ ચેકરીબીનની કુદરતી ઉપચારોપરની લેખમાળાના આ લેખ પ્રસિદ્ધ કરીએ છીએ. કુદરતી ઉપચારો સંબંધી વાંચકો કંઈ પણ પ્રશ્ન પ્રુછ્યા અથવા સલાહ ઈચ્છતા હોય તેણે તેના જવાબ મી. ચેકરીબીન આ પત્રદ્રારા આપશે.—અ.ઈ.આ.]

હુક વર્મ નામના કરમ ન્યાં ગરીબી, અગોણુ અને અસ્વસ્થતા હોય ત્યાં સામાન્ય રીતે થાય છે. આથી દર્દમાં, ઉપ્ચારોમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ના દક્ષિણ ભાગમાં અને અન્ય દેશો ન્યાં ગરીબો મોટી સંખ્યામાં કરમ બેચબાળી ગઈ જવ્યાઓમાં વસે છે. ત્યાં તેતું પ્રમાણ વધારે જ્ઞેવામાં આવે છે.

આ કરમ પેટના અંતરડામાં ધીન કરતોની સાથે એક ટુકની જેમ વળગી રહે છે, દરદીની તે શક્તિ યુસી ખાપ છે જેથી દરદીનું મોઢી ઊડી જાય છે અને ધીન જેવાં દરદો થાય છે.

જે લોકો કાદવમાં, ખાણમાં, તળાવોમાં, ગંદાઓમાં ન્યાં હુક વર્મના ઇંડાં પુષ્કળ પ્રમાણમાં હોય છે, ત્યાં કામ કરે છે, તેઓને તેનો ચેપ લાગે છે, વળી આ, કોચીના ખેતરોમાં, શેરડીના ખેતરોમાં કામ કરનારોને તેમજ શાકભાજી ઉત્પાદનારા અને તેની લેવવડેવા કરનારાઓને પણ ચેપ લાગે છે.

હુક વર્મના ઇંડાં જેટલાંથી નીકળે છે અને પછી તે જીનના પર ફેલાય છે અને ઉગેરે પડે કરનારને અથવા હાથથી માટીમાં કામ કરનારને તે લાગે છે. પુહલા હાથ પકમમાં લાગી જઈ તે ચામડીની અંદર દાખલ થઈને રકત વહીનીમાં દાખલ થાય છે અને તે વાટે ફેફસાંમાં પહોંચે છે અને ત્યાંથી નાળા નો રસો કોચીને જ્ઞાસની નળીમાં દાખલ થઈ ગળામાં આવે છે અને સાંધી તે ગળી જવાય છે અને ડોળરી માં દાખલ થાય છે અને ત્યાં પેટના અંતરડાની દીવાલે વળગી રહે છે અને લોહીને યુસી ખાનારા પદાર્થો બહાર કાઢ્યા કરે છે.

હુક વર્મ વાળાઓને ખાંસી યુગ થતી જ્ઞેવામાં આવવે, લોહી વાટે આ કરમ ફેફસામાં જઈ જ્ઞાસની નળીમાં થઈ ગળામાં જાય છે ત્યારે ખાંસી થાય છે.

ગંદી રહેણી કરણી હોય, ગરીબી હોય, જ્ઞેપ્તે તેવો ખોરાક લેવાતો નહિ હોય ત્યાં આ કરમ વધારે થાય છે અને મલેરીયા વિગેરે ધીન રોગો વાળા દરદીઓને તે વધારે ઠુ:ખી કરે છે.

હુક વર્મ વાળા દરદીઓ આળસુ, પુહિલ્લિન અને માંદલા જ્ઞેવામાં આવે, તેઓનું મન શીથિલ થઈ ગયું હોય છે. તેઓનામા શક્તિ નથી હોતી, કોષ

તબતબા ઉત્સાહ કે સ્ફુર્તી હોતાં નથી, તાવ આવે છે, પેટના દરદો થાય છે, છાતી બળે છે, કમજબાત થાય છે, કાચેરીયા થઈ આવે છે અને છેવટે તે હૃદયને અને આંખને પણ હરત કરે છે. દરદીઓ યદુ પાળના અને લોહી વિના ના થઈ જાય છે, તે એટલા શક્તિ ધીન થઈ જાય છે કે ખીલું કોષ દરદ થઈ આવતા તે તેના બોગ થઈ પડે છે.

તેના ઇલાજ તરીકે યાદખેલ અથવા કારખન ટેટ્ટે કલોરાઇડ ઇકતરની સુચના યુગ્ય લેવામાં આવે છે, અને તે દુર થયા બાદ સારો અને પુષ્ટીકારક ખોરાક અને ધીન કુદરતી ઉપચારો કરવા પડે છે. આવાં દરદ વાળાઓએ સ્વસ્થતાની ઘણીજ કાળજી રાખવી જોઈએ. કંઈ પણ ખોરાકને હાથ લગાડતા પહેલાં હાથ પહેલાં પાણીમાં યુગ્ય ઘોઈ સાફ કરવા જોઈએ. જાનર મુખા પછી પણ હાથ યુગ્ય ઘોવા જોઈએ, પીવાનું પાણી ધીલકુલ ચોષ્ટું હોય તેની બરોબર કાળજી લેવી જોઈએ. ઘણા બરા કરમના દરદો પાણી ચોષ્ટું નહિ પીવામાં આવવાથી થાય છે, ઘણી વાર પીવાનું પાણી છીછરા કુવામાંથી અથવા જાનવરો કે જીવનુંતુઓએ ગંદા કરેલા પાણીમાંથી લેવાનું હોય છે. ટેટલીક વાર નજીકના જાનવરોમાંથી ગંદું પાણી પુષ્ટ થતાં બજેલું હોવાનો સંભવ રહે છે.

ખોરાકની વસ્તુઓ ખાસ કરી લીલો તરીકે સાફ પાણીથી યુગ્ય ઘોવાવી જોઈએ. ખાસ કરી માનવીના કે જાનવરના અળતા ખાતરમાં એ વસ્તુ એ ઉત્પાદમાં આવેલી હોય ત્યાં તેની વધારે કાળજી રાખવાની જરૂર રહે છે.

કુવરા, ખીલાડાંને હાથ ઝેડેડું ચાટવા દેવાં નહિ જોઈએ. જેવાં જાનવરો માંથી ચેપ લાગવાનો ઘણો સંભવ રહે છે.

આજકોને કુવરાં ધીલાડાંને સુખન કરવા દેવા અથવા તેઓને ધીલાડામાં સુવાડવા દેવાં નહિ જોઈએ. કુકર વીગેરે જાનવરો ન્યાં વસતા હોય ત્યાં ઉઘાડે પડે ફરતું નહિ જોઈએ.

કાચું માસ ખાણું નહિ જોઈએ અથવા જે જાનવરને ઓળી નીકળેલા હોય તેવાં જાનવરનું માંસ નહિ ખાણું જોઈએ. તંદુરસ્તી ખાતાંના ઈન્સ

પેકટરે બરોબર તપાસેલ નહિ હોય તેવું માંસ પણ ખાણું ન જોઈએ.

માનવીઓએ મળ ત્યાગ કરેલા હોય તેને અને ખાસ કરી કરમવાળાઓના મળને બરાબર જીનમાં દાટી દેવાની કાળજી લેવાની જોઈએ.

ધીનઓ ચાલતા હોય ત્યાં લોકોએ યુકવું નહિ જોઈએ. લોકોએ પુહલી જ્ઞવામાં મળ ત્યાગ કરવો નહિ જોઈએ અને જો તેને આડા ખોદી તેમાં મળલામ કરી તે માટીથી બરોબર

ઢાંધી દેવા જોઈએ. ગોખા અને પુહિકારક ખોરાક જેવા કે, કાગાં તામું સેલેડ, જીન ની અંદર ઉગેલાં શાકભાજી, તામું જળ સુકો મેવો વિગેરે ખાવાં જોઈએ. કરમ કરનારી વસ્તુઓ જેની કે રસીકા, કેક, સંદેદ રોડી વિગેરે નહિ ખાવાં જોઈએ.

ચરીર તંદુરસ્ત હોય તે તે રોગને સામનો કરી શકે. કુદરતના નીવંધોનો બંધ કરનારનેજ રોગ થાય છે. તેનું સુસ્તપાલે પાવન કરનાર સુરક્ષિત રહે છે.

સંત સામાજ્યમાં

સંપ્રકડતો : છગનલાલ ડી. મીન્ટ્રી, ટ્રાંસવાલ.

(૧) રામાનંદ

રામાનંદજીએ ધાર્મિક વિચારો અને બકિત માર્ગને દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં લાવી તેનો પ્રચાર કર્યો. અને પોતાના સંપ્રદાયમાં દરેક જાતના લોકોને જોળ્યાં. બનારસમાં વિદ્યાન સુસઠમાનોની સાથે રામાનંદની મુલાકાત પણ થઈ હતી. રામાનંદના શિષ્યોમાં યદુ અવધાણીઓમાં સુસઠમાનો પણ હતા. તેના બે શિષ્યોના નામ સુપ્રસિદ્ધ છે. એક તુલસીદાસ તથા ધીન સંત કંપીરજી. ગોસ્વામી તુલસીદાસજીના રામજકિત સમરત ઉત્તર ભારતમાં સુપ્રસિદ્ધ છે.

(૨) સંત કંપીર

આપણા દેશમાં ૧૨ મા યી ૧૧ મા રોકા સુધીના ગાળામાં જે અનેક સંતો થઈ ગયા, તેમાં કંપીર અને નાનકનાં નામ વિશેષ પ્રખ્યાત છે. એ વંધોને જાણે એટલે આપણે ત્યાં ઇસ્લમ ધર્મ અને સુસઠમાનોનું રાજ વધવાનો સમય. આ બે મહાત્માઓ પોતાના જમાનાના હીંદુ તથા સુસઠમાન જેવે પ્રિય હતા. આ બેજે મહાત્મા ઝોના મરણ વિગે એક સરખી લોકકથા ચાલે છે. તેપરથી તમને આ રપટ સમજાશે.

કંપીરજીએ જ્યારે દેહ છોડ્યો ત્યારે ઝોના હીંદુ અને સુસઠમાન ઝેલાઓ માં વાદ વિવાદ ચાલ્યો : હીંદુઓ કહે, અમારા યુરના સળને અમે અનિદાહ કરીશું. કંપીરજીના સુસઠ-

માન બકતો કહેવા લાગ્યા, “ના અમને ઝોનાના શળને જૂમિદાહ કરવા દો અમે ઝોમને કબરમાં દાટીશું.” આ વાદ વિવાદ વધી પડ્યો. ગડામાં પડી એક બલા બકતે કહ્યું બાઈઝી, એક યુરના ઝેલાઓ આમ લડે એ તેા શોભાવનાંકું ન કહેવાય. ચાલો, પહેલાં આપણે ઝો આપણા પ્રિય યુરજીના દર્શન કરીએ. દર્શન કરવાને માટે થયપર ઝોડાડેલી ચાદર કે કદન ખસેડવામાં આવ્યું ત્યારે એક નવાઇ પમાડે તેવો ચમકાર સૌ એ જ્ઞેવો. ચાદર નીચેથી શળને બસલે જુલોનો દમ નીકળ્યો. ઝમડા તેા અંત સહેલાં થઈ ગયો. અધી કુલ હીંદુઓએ અને અધી કુલ સુસઠમાનોએ લીધાં. આ વાત પરથી એટલું જણાય છે કે, કંપીરજી હીંદુ સુસઠમાન બે ઠોમમાં માનીતા હતા. આવીજ વાત નાનકના મરણ વિગે પણ કહેવાય છે. એમને વિગે આજ અર્થ ખતાવનારો એક લોકિક કુહો અવધારે પણ યોલાય છે.

“યુર નાનક ચાહ કંપીર, હીંદુકા યુર, સુસઠમાનકાપીર”

કંપીર અને નાનકનાં કંપીર પહેલાં યથા હતા. ઝોમના જીવન વિગે ખાતરી બંધ હઈકતો અંધી મળે છે. જે મળે છે તે બાળત વિદાનોમાં કેટલેક મત બેઠ પછી છે. તેમનો જન્મ ઇ. સ. ૧૩૮૮ની સાલમાં એક વિધવા યજ્ઞાણીના પરે થયો હતો. તે બંધાણી એ પોતાની યરમ છુપાવવા માટે બાળક જન્મતાવતે છાંડી દીધો. નીમા-

અને નીચે નામનાં કાર્ડી પાસે રહેનાં એક મુસલમાન વ્યક્તિ દંપતીએ પોતાને ઘેર લઈ જઈ તેને ઉછેરી મોટું કયું. આ રીતે કબીરેઈનાં પાલક માતા પિતા મુસલમાન વ્યક્તિ હતા.

કબીરના સમયમાં રામાનંદ કરીને એક પ્રખ્યાત સંતપુરૂષ કાર્ડીમાં પોતા ના મહામાં રહેતા હતા. નાનપણથી કબીર ધર્મપરાયણ હતા એમજી વિચાર કર્યો, મારે રામાનંદના શિષ્ય થવું જોઈએ. પરંતુ મુસલમાન મણાતા કબીરને કૌણ મંત્ર આપે ? રામાનંદ રોજ પરોવિયે ગંગાપર

રનાન કરવા આવતા. કબીર એક દિવસ એમના મોગમાં ગંગાવાટના એક પગથિયા ઉપર વચ્ચે સુતા. અંધારામાં રામાનંદનો પગ એમના ઉપર પડ્યો અને મોઢામાંથી ઉદ્ધાર નીકળ્યો. અરે રામ-કોઈ કયારાણું કે. યું ? કબીરજ તરત ઉઠીને ઉભા થઈ યુરજીને સાંપડાંમ નમસ્કાર કરી ઘેર ગયા. ત્યારથી એમણે માની લીધું કે મને યુરજીએ રામ મંત્ર આપ્યો અને ચરણરજથી પાવન કર્યો. પછી એ મંત્ર જપતાં જપતાં તે પોતાની સાધના કરવા લાગ્યા.

(અધુરું)

મારા જંગલના બાળકો

લેખીકા : ઇડય બીઈરેટીન

[યુનાઇટેડ નેશનસ વર્લ્ડ હેલ્થ ઓરગનાઇઝેશન તરફથી એક ડેનીશ નર્સ ડ્રોસ, હંગરી, અને જર્મનીમાં કામ કર્યા પછી હાઈનાં નવા અનુભવો મેળવવા ગયા છે. ત્યાંના જંગલોમાં શું શું તકલીફો તેના માગ વચ્ચે આડી આવી હતી અને એનો સામનો તેમને કેવી રીતે કર્યો તે આ લેખમાં તે મેન જણાવે છે.]

જ્યારે દક્ષિણ હાઈના જંગલોમાં મેં પ્રવેશ કર્યો ત્યારે મને દસવું આગવું હતું કારણ કે હું સુંદર સ્વચ્છ નર્સના સરદે કપડામાં સજ્જ હતી. અને કાદવ કીચડ યુદ્ધને ચાલી મારે બાથગુના પ્રયુદ્ધમાં વાસ કરવાનો હતો. મારી સાથે જે હાઈ સાથી હતી તે મારા કપડા જોઈને આશ્ચર્ય પામી હતી.

એક જુવાન માની પહેલી સુવાસ માટે અમે ઉનાળાની એક રાતના ઘણા કલાકો સુધી પ્રસૂતી વેદના જોગવતી માને રાહત આપવા મેહેનત કરી હતી. ત્યાર બાદ અમારે જંગલોમાંથી ઘોડાક માઈલ પસાર કરીને પાસેમાં પાસેના માગ કે જ્યાં અમારી છપ કાર રાખી હતી ત્યાં પહોચવાનું

હતું. મને હરવું એથી આજુબુંડે જ્યારે મે નર્સોનું કામ હાથ ધર્યું ત્યારે આવા કાર્ડની કલ્પના પછુ મને નહોતી. કલ્પનામાં તે હું પોતાને એક બીજા ફ્લોરનસ નાઇટીંગેલ માનતી હતી કે જેને હોસ્પીટલમાં દરદીઓની છેલ્લામાં છેલ્લી દવાઓને ઉપયોગ કરી સેવા કરી હતી. મે મહીના પછી હું એક બળદ ગાડીમાં ઉઠ્યા ઉઠ્યા વાસ અને જંગલોના ખાંડા ટેકરા વાળા રસ્તાઓપરથી પસાર થતી હતી અને પરસીણાના રેબાથી માઈ શરીર બીજાનું હતું. સવારના પહેરેલા સુંદર સ્ટ્રાપ્સથી ઘોવાયેલા નર્સના સરદે કપડાનું રૂપ ન ઓળખાય એવું થઈ ગયું હતું. ક્યાં મારી કલ્પનાની સ્વચ્છ અને સુંદર હોસ્પીટલ અને તેમાં સ્વચ્છ કપડા પહેરી ફરતી હું નર્સ અને ક્યાં મારી આ અનુભવ.

જ્યારે અમે પહેલા ગામડામાં પહોંચ્યા ત્યારે અમને જોઈને ઓંચા અને નજા બાળકો ચીસો પાડતાં જંગલોમાં છુપાઈ ગયા. તેઓએ કદી પછુ જોરી જોઈને જોઈ ન હતી. અમારું પહેલું કામ તેઓના વિશ્વાસ મેળવવાનું હતું.

આ પ્રદેશનું નામ ટેરાઇ હતું અહીં મનેરીવાનો ઉપદ્રવ ઘણા મોટા પ્રમાણ માં હોય છે. અને તે ઘણા હાની કારક રોગ થઈ પડ્યો છે. ધીમે ધીમે અમે વિશ્વાસ મેળવવામાં સફળ થયાં ગયા. તેમના માટીના ઘરોમાં જઈ એમના બાળકો અને સગાઓને નવી દવાઓથી આ ભયાનક માંદગીમાં થી રાહત આપવાનું શરૂ થતાં આ અમારું કામ ધીમે ધીમે બધાને કાને પહોંચ્યું. એક ગામડામાં ૨૬ વર્ષ બાદ અમે પહેલાજ બહારના માણસ તરીકે મેમાન થયા. ઘણા ગામડાઓ એવા છે કે જેને આમને મુદ્દ કે મહાત્મા ગાંધીની કશી વાતો ખબર નહોતી. ડેટલીકવાર અમારી દવાઓ કરી અસર વગર નિષ્ફળ જતી. આ આશ્ચર્ય હતું પછુ પાછળથી જણાયું કે અમારા ઘણા દરદીઓને જે ગોળાઓ આપાતી તે છુટા કરીને પ્રસાદ તરીકે કમ્રાળ પર ચોપડતાં. પછુ ધીમે ધીમે ધીરજ પુલક સમન્વવવાથી આ સાથે દીલના છતાં સંકેપાતા જંગલના લોકો સાથે મૈત્રી થતી ગઈ અને તેઓના ઘરોમાં ડી. ડી. ટી. છાંટવા ની પરવાનગી મેળવી. આમ દવાનો ઉપયોગ મોઘ થતો ગયો અને મેલેરીયાથી વધુ રાહત મળતી ગઈ. આની રીતે હેલ્થ નર્સોએ પ્રદેશનું સ્વરૂપ બદલી નાખ્યું પછુ આ તે ઉત્તર પ્રદેશના જંગલોના હેવાક છે. આ લેખ હું જ્યાંથી લખી રહ્યો છું તે પ્રદેશ મૈસુરના દક્ષિણ છે. આ ગામડાથી પાસેમાં પાસે ડોક્ટર ૩૦ માઇલપર છે. અહીં ઘણા લોકો રૂમેટીક શીવર, કોલેરા, ટાઇ- ડીફ, ડાઇ, અને સારા ઓરાકને અભાવે બીજા રોગોના જોમ અને છે. હું અને મારી મે હાઈ સાથીઓ અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં અમને એ અનુભવ થાય છે કે લોકોને સૌથી વધારે શારીરિક ક્ષણ યું કામ અને કેમ કરવી તે જાનની ઘણી જરૂરત છે. આ કામ અમે મીનીટ ની પછુ કુરસદ વગર કરે જઈએ

છીએ. અમારા દુકમત નીચે આવતાં જોમડાઓમાં બધાની પ્રથમ પ્રાયશીક તપાસ કરવામાં આવે છે અને ત્યાર બાદ અલ્ટ્રાવીવાના ચોક્કસ ગામડાઓ ભઈ તે જોની પુણી તપાસ કરીએ છીએ. એકે એક ઘરમાં જઈને તપાસ કરી અને ત્યાંના દરદીઓને યોગ્ય મદદ કરીએ છીએ. જ્યાં જ્યાં લોકો ટોળે મળતાં ત્યાં ત્યાં તેમને આરોગ્યની મદદવતા વિશે સમજણ આપતાં.

ગામડાના ઘણા લોકો માને છે કે મેલેરીયા જીવ પ્રેતનો ઉપદ્રવ છે, આ વરસાદને લઈ થાય છે. આ લોકોને ધીરજથી સમન્વવવા મજબૂરના મોટા મિત્રો કાઢીને જ્ઞાન આપીએ છીએ. આમ છતાં અમે જોઈએ કે તેઓ તે બધી વાત રજુજમાં હસીને ખ્યાનપર ન લેતા અને અમને કહે કે આવા મોટા મજબૂર તમારા દેશમાં યતાં દરો અમારે ત્યાં તે બંધના મજબૂર છે.

ગંધ બાળકોને અમે અને નવડાવી સાફ કરીએ જ્યાંથી તેઓ સમજી શકે છે સ્વચ્છ રહેવાથી આરોગ્ય જળવની શકાય છે. નાનાઓ તથા મોટાઓના મનમાં એ વાત ઉતારવી મુશ્કેલ જણાઈ કે મોઘ પછુ જન્મના ઘા ઉપર સ્વચ્છ કપડું બંધાવવું જોઈએ. તેઓ સુનો અને ખાંડ બેગી કરીને ચોપડે અથવા છાણ, મેલસા કે તેલ ચોપડે. એકવાર એક નવ વરસના છોકરાએ મારી પાસ માથાનો દુઃખાવો મટાડવાની દવા માંગી મને ચંકા ગઈ કે તાવ હશે તેને તપાસતાંજણાઈ કે તેના માથાપર પંથર જેવો કંઈક પદાર્થનો ટૂંકો બાંધો હતો. તે બાળકના બાજીએ અકસ્માતથી રમતા રમત. તેના માથાને કુહાડા વમાડ્યો હતો અને તેથી હડો ધા થવા પામ્યો હતો આ ધા પર એક ડાકરીએ યુનો અને ખાંડનો સખંત જોવા બનાવી બાંધ્યો હતો. ક્યાક સુધી મે કાતર વગેરે સસ્તોથી તેને દુર કરવા પ્રયત્ન કર્યો બાદ તે સાફ કરી શકાયો તે પર મક્કમ વગેરે ચોપડીને સાફ પાટો બાંધ્યો. અલ્ટ્રાવીવા બાદ ધા સાવ સારા થયો.

ગ્રોસરી મળવાનું ભરોસાપાત્ર મથક

JHAVER HIRA & CO.,
118 Victoria Street,
DURBAN.

Phone : 24932
Res. 24845.

અમારે ત્યાં

મોંધીવડુ, કોળ, હવન, યુજની સામગ્રી અને હવન બજારી દરેક જોઈતી-વસ્તુઓ મળશે.

સાહકોનો સંતોષ એજ અમારો સુદા લેખ છે. એકજ વખત મંગાવી પાત્રી કરો. માલ સારો અને નોખાંબો જતી દેખરેખ નીચે મોકલવામાં આવે છે. કંડી ઓફિસ સી. ઓ. ડી. થી મોકલવામાં આવશે.

હોદ્દરયાનના બાળકો વણા સુંદર હોય છે. મારી પાસે એક બાળક લાવવામાં આવ્યું હતું તેની એક ફરીયાદ એ હતી કે તે દુઃખેશ રહે છે. શરીર કાંટલા કપડાથી માંડ માંડ વાકય હતું મેલ પશુ શરીરપર પોતાનું રાજ્ય સ્થાપી ચોટાથો ઢોલો. ગરમી સખત હતી. આથી મેં એ બાળકને ઘસીને સાણથી સાફ કર્યું. ખીજ અકાદીએ એની મા એક સ્વચ્છ અને સસકત બાળકને મારી પાસે લાવી અને જીવ્યાંથી કે, આ તમારું બાળક છે અને તમેજ અમારી મા છે. હોદ્દરયાનીઓની આભાર પ્રદર્શન કરવાની આ રીત છે. એક બેબી શોમાં પાંચ ધનામ મેળવનારા બાળકો મારી કોન્સીલમાંનાં હતાં. પેસાદાર વગેના બાળકો તેમના સુંદર કપડા અને દાગીનાથી લદાવલા શરીર થી ઘુરત ઓળખાઇ આવે છે છોકરીઓના નાક કાન નાનપણથી વિધવા માં આવે છે. પહેલા તેમાં ન્હાની રળી પારવે છે અને પછી તે રળીની જગા હીરાગોતી લે છે. યંદીના દીવસોમાં બાળકોને જરૂરી પહેરાવવા માં આવે છે. પશુ ચણી બાગેજ પહેરાવે. આ લોકોની માન્યતા છે કે શરીરને ઉપલેા બાગ ગરમ રહેવો નેપછએ.

સાવ નાના બાળકો અથવા ચામના શીખનારા બાળકો અથવા નીસાણે જતા બાળકોમાંથી સૌથી વધુ કોણ પ્રીય છે. રોજ આમમાંથી કામને જતાં આઠ નવ વરસના બાળકો અમને જાત જાતની રીતે સલામ કરે છે. મિઝ છોકરો તેો એમ મને છે કે રોજ છુટી રીતે આવકાર આપવો. એક દીવસ એક પખપર ઉભો રહી બાંધે પગ માંધા સુધી લાવી અંગેજીમાં મને "યુઝ મેર નોઝ" તે બાળકે કહ્યું હતું. આમડા માંની આઠ શાળામાંના ૪૪૫ છોકરાઓ દર અઠવાડીએ અમને મળે છે. બાળકો એ અમારે માટે સુંદર દુલો બેટરૂપે લાવે છે અને છોકરાઓ લીંણુ કાકડી કે સોપારી લાવે છે. દાપ પમ પોતા કે નખ સાફ કરતા તેઓ મેણે મેણે આનંદ આવે છે. પહેલા મારી પાસે એકજ કાતર હોવાથી એક લાઇનમાં ઉભા રાખી તેઓના વારા ફરતી નખ કાપ્યા હતાં. મને બપ હતો કે તેઓ યાકરો પશુ તેઓ આનંદ માં ગીતો આઇ રલા હતાં અને વખત વીતાવતાં હતાં. પહેલાં હું ડરતી કે આ સંક્રાંતનું પ્રદર્શન બાળકોને મારાથી વિષયુ કરશે. પશુ મેં જ્યેયું કે તેઓ આનંદથી મને વધારી લઇ ખીજ વાર વધુ સાફ થઇ મારી પાસે આવતાં. મોટા બાગે આવનારાની જમર ૭ થી ૧૫ વર્ષની અંદરની હોય છે પશુ કેટલીક વાર મોટી બેનો પોતાના ન્હાના બાંકુ

ઓને લાવે છે કારણુ મા અને બાપ બન્ને મજુરીએ ગયા હોય છે. ઘણી વાર મોટાઅ. પશુ આવે છે કે ને કામ કરવા માટે ડોસા થયા હોય છે તેઓ ચિખવા માટે બાળકો નેટલા ઉત્સાહથી ફુરાવે છે. અજીત જાતીના ધરોમાં પશુ અને જીવ સંક્રાંત શીખતીએ છીએ. અને ને લોકો શીખવા માગતા નથી તેઓને ધમકાઇ પશુ આપવી પડે છે ધમકાઇમાં અને પોતે સાફ કરશું એવું જીવ્યાનીએ છીએ, અને પોતે તેમજ આમના બાળકો મળીને સાફ કરવા મંડી પડીએ છીએ ત્યારે શરમને લઇ તેઓ પશુ ધર સાફ કરે છે. મને મદદ કરવામાં બે છોકરાં ઘણા ફુરીયાર અને ઉસાહી મળ્યા છે. તેઓ દાખાનું સાફ રાખે પાણી લાવે અને દરદીઓના જોડાઓ ને બરાબર લાઇનમાં રાખે. ધેર જતી વખતે સામાન યુકવામાં મદદ કરે અને અમારી સાથે હેપ કારમાં અમારા ધર સુધી આવે. આ બધા કામનું પરીચામ યું? આને મામડા ના બધા લોકોને ધરોમાં ડી. ડી. ડી. વાપરતા કરવામાં આયાં છે. હબરો મચ્છરોને પકડીને મલેરીયાની તપાસ કરાય છે. તેમજ હબરો ઉદરને પકડી પ્લેમની તપાસ કરવામાં આવે છે. ડી. ડી. ડી. વાપરવાના બે વર્ષ દરમિયાન એક પશુ પલેખનો બનાવ

અમારા ફુકમત નીચે થવા નથી પામ્યો. આમડાઓમાં અચાઈ કાઈ સવેજે આ- જા જાવ છે. શાળામાં પશુ કાપલા ઓ જીવ્યા છે. જ્યારે અને મામડા માં કામ કરવા જઇએ છીએ ત્યારે દુઃખેશ આનંદથી લોકો ઠોંગે મળી અમને આકારે છે. હવે તે અમારી પાસે ડાકરો છે મચ્છર તથા ઉદર પકડનારા ઉપરાંત નેસો પશુ છે. જેમ બેતીમાં બી વાળા બાદ ફળની રાહ બેની પડે છે તેમજ આવા કાર્યમાં પશુ ફળની રાહ બેની પડશે. અમારી યુક્ત ટુંકે સમયની જ છે. પશુ અને આશા રાખીએ છીએ કે બાળકો આ ખીજના કળ બોનરો.

આપ આઠકે બન્યા?

ચિત્ર લેખા

ત્રતી: વજી કોઠક

વાર્ષિક આઠકને એકજ વર્ષમાં બે બેટ પુરતકો, ખાસ અંક અને દીવાળી અંક આપનાર યુવરાતનું એકજ લોક પ્રિય સાપાહિક.

વાર્ષિક લવાજમ શીલોન ૩૬.

ચિત્ર લેખા કાર્યાલય

સીએલેક્સ કંડીયા હા.

૮૬ પ્રી-વેસ સ્ટ્રીટ,

ચુંબક, ૧. (ઈન્ડીયા.)

ગ્રોસરી ક્યાંથી ખરીદશો ?

"બાનતી ઝંપે, સારો માલ, કિશમત ભાવે મોકલાવશું" એમ અમેજ કહીએ, તેના કરતાં અમારા આહડોના સંજ્યાબંધ પ્રમાણપત્રોમાંના થોડાંક આપીએ છીએ, તે વાંચશે એટલે આપને ખાતો થશે કે "આહડોને મતોષ આપવો" એ અમારો પ્રદાલેખ અતિશયોક્તિ બધો નથી:-

| | | | |
|--------|--------------------|-------------------|-----------------------|
| શ્રીમા | પરભુભાઈ | SIMONSTOWN. CAPE. | માંખીવહ |
| શ્રીમા | વજીવવાલુકે | શ્રીમા | કોડર |
| માલ | અબો આપહીલા | શ્રીમા | પર-ગરુ હવાઓ |
| માલ | દાંજી સારો છે. | શ્રીમા | હવન-પુલની સામગ્રીઓ |
| શોર્કર | આપ શું તા.૨૫-૧૧-૫૧ | શ્રીમા | બનારસી સાડી |
| | | શ્રીમા | ચુંબક સમાચારના પંચાંગ |
| | | શ્રીમા | ક્રીમત સી. ૩-૬. |

અરેસ:
૧૧૦ વીકારીયા સ્ટ્રીટ, દરબન.
ફોન: ૨૪૮૪૫.

પરભુ નરસીહ એન્ડ કુ. (પી)
લીમીટેડ
દરબનના ૩૦ વર્ષની પુરાણી અને સુપ્રસાદ્ય દુકાન.

સર્વ માલ સી. એ. ડી. થી મોકલાવવામાં આવશે.

રજકણુ

મહાભારતનું એક દર્શન આજની પરિસ્થિતિમાં ખાસ વાદ આવે છે. બળદ અને માખને એક રાજ્ય મારતો હતો, તે બેદ પ્રરીક્ષિત રાજ્યને એને પ્રુથ ભવ બતાવ્યો, ત્યારે પંડેરા રાજ્ય શરણે આવ્યો ને કમ્પ્યુંકું પે પોતે કહી હતો. શરણે આવવાને ક્ષમા આપવી એ રાજની ક્રુજ હતી. કહિ ઉપર રાજને દયા આવી. તેણે બળદ તરફ કરીને પ્રુથ્યું: 'બાહ, તમે કોણ છો?'

'હું રાજ, હું ધર્મ છું. પરંતુ કાળ બળથી હું ક્ષીણ અને નિર્બળ બન્યો છું. તે' યોગ્ય સમયે આવવાને અમને બચાવ્યાં છે. અરેઅર, તું ધર્મસ્થક છે.' રાજને ગામને પ્રુથ્યું: 'માતાજી, આપ કોણ છો?'

બાહ, હું પૃથ્વી છું. હું પશુ ધરડી ઘણું છે. હવે શક્તિ રહી નથી. આ ઘુષ્ટ માણસ અમને મારતો હતો.'

રાજ તે ધર્મ સંકટમાં પ્રુકામો. પશુ હવે શું યાપ? થોડો વખત વીચાર કરી રાજને કહ્યું:

'હું કહિ હું તને છવતદાન તો આપું છું, પશુ આજથી તારે મારા રાજ્યમાં ન રહેવું.'

કહિ કરચરીને કહેવા લાગ્યો: 'મહારાજ, મને દેશવટો ન દેશો. આપ ના રાજ્યમાં અસંખ્ય છવો રહે છે અને ઉદરનિર્વાહ કરે છે તેમાંથી મને થોડો ભાગ રહેવા ન આપો?'

રાજને કહિની રિચિતિ બેદ દયા આવી.

'બલે જ, પશુ તું રહીશ ક્યાં?'

'આપ કહેો ત્યાં.'

'હીક, જન. જ્યાં જુગાર રમતો હોય ત્યાં તારે નાસ કરવો.'

'મહારાજ, ખસ એક જ જગા?'

'કેમ બોલો છો? તો જન. જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં પશુ તું રહી શકે છે, ખસ?'

'મહારાજ, મારો પરિવાર લાંબો છે; આ બે જ રચાનોમાં હું કેમ કરીને રહી શકું?'

'એમ? હીક જન, જ્યાં બચિચાર અને હીસા થતાં હોય ત્યાં પશુ તું વાસ કરજો.'

'રાજાજી, જેવી આપની આજ્ઞા, પશુ એકાદ રચાન વધારે આપું હોત તો સારું થાત.'

'અરે! તું તો બારે લોખી લાગે છે! જન. એક વધુ જમા આપું છું, પશુ હવે માગીશ નહિ. અનીતિથી મેળવેલું જ્ય જ્યાં હોય ત્યાં પશુ રહેજો. જા હવે જતો રહે. આ જમાઓ સિવાય જો બીજો ક્યાંય દેખાયો તો તારો પ્રાથુ દરીશ.'

* સાપરમતીમાં * એક અનશાસ્ત્રી આજ્યા હતા. અનાજને વિધિવધ રીતે પાણીમાં પલાળીને ખાવા માટે બધાને તે આપતા હતા.

એક દિવસ ગાંધીજીને ઉધવાની સમય થયો હતો, ત્યારે કરતુરળા એમ ના માધમાં તેલ ઘસતાં હતાં તે બીજા પશુ કેટલાક આશ્રમવાસીઓ ઉભા હતા. અનશાસ્ત્રી પશુ ત્યાં હાનર હતા અને પોતાની ધુનમાં હતા, તે યોલ્યા:

'બાપુ, કુંધ મનુષ્યોને ખોરાક નથી. માતાનું કુંધ જ મનુષ્યોને સ્વાભાવિક ખોરાક છે; આપ બકરીનું કુંધ લો છો તે પશુ ઉચિત નથી, પશુનું કુંધ પીવા યી પશુના શુણ આવવા માટે છે.'

બાપુને ઉધવાને સમય થવાથી, આખાંડે હસી પડતાં, પોતાના પગ લાંબા કરી ચાદર ઓઢતાં યોલ્યા:

'હા, તદન સાચી વાત છે તમારી, જુઓ બકરીનું કુંધ પીવાથી મને શીંખ ડાં ઉભા પાંડમાં છે, હવે તમે બધાં બાગો નહાં તો ધીંમડું મારી દર્ધશ!'

પરચુરણુ

—શીખએ ૨૫ વર્ષમાં રચુને જંગલ માં ફેરવી નાખ્યું છે. આવા બે રજો આજે લીલા ઝાડોથી દરીયાળા બન્યા છે. આ રચુમાં બી વિમાન મારફતે નાખી રોપાય છે અને તેમાં ઉગનારા રજો બળતણ માટે વપરાય છે.

—ભારતમાં જનતા એકસ્ટ્રેસ ઢોડે છે કે જોમાં પહેલો બીજો કે ત્રીજા વર્ગને બેદ પથી હોતો. મારી ૨૦ ટૂંનો છે.

—હિંદી સરકારે કોપરાપર ૭૭૫ ટકા જકાત હતી તેમાંથી ૨૫ ટકા જકાત કરી છે.

—હિંદમાં વધુ બે યુનીવર્સીટીઓ રચાપવામાં આવી છે. પદના યુનીવર્સીટી અને બીહાર યુનીવર્સીટી.

ગણિત ચમત્કાર

સંચલકરતા : છગનલાલ

(૧) ૯૯ ના આંકડાથી ગમે તે બે આંકડાની સંખ્યાને ગુણાકાર ૪૮ થાય છે. દા. તેને ૧૦૪૯૯=૧૬૩૩. રીત ૬૭ માંથી એક બાદ કરો. ૬૬-૯૯ માંથી બાદ કરો. રહ્યા ૩૩. ૬૬૩૩ એમ મુકો એ જવાબ.

(૨) કોઇની અમર ધારો તેને ૨ વડે ગુણો તેમાં ૫ ઉમેરો પછી ૫૦ વડે ગુણો તેમાંથી ૩૬૫ બાદ કરો પછી તેમાં ૧૧૫ ઉમેરો. છેલ્લા બે મીડા આવશે તે છેકી નાખો બાકીની રકમ તે ઉમર.

નવાં પુસ્તકો

રાષ્ટ્રભાષા શીખવા માટે
હિંદુસ્તાની-ગુજરાતી કોશ શી. ૧૦-૦
ગાંધીજી અને સામ્બવાદ. " ૩-૦
પ્રસામનો સુવર્ણ યુગ. " ૪-૦
દેશ દેશની લોક કથાઓ < ૬
શહીદોનો સદેશ ૪ ૦

મળવાનું કેાણું આ ઓશીસ

મુળાક્ષરના નકશા

બાળોને, અક્ષર જ્ઞાન આપવા માટે આ નકશા ઘણું ઉપયોગી યદ પડે છે. કીમત શી. ૭-૬.

દેશ નેતાઓની મદી સંખ્યા લાયક છબીઓ

સૌએ પોતાના ધરમાં મદી રાખવા લાયક સુંદર આઈપોપર ઉપર છાપવામાં આવેલી દેશ નેતા ઓની છબીઓ.

મહાત્મા ગાંધી.

પુ. કેરતુરખા.

સરદાર વલ્લભભાઈ પટેલ અને

પંડીત નેહરૂ સાથે.

શ્રી. અરવીંદ યોષ.

દેરેકી શી. ૧

માર છબીઓ સાથે લેનારને શી.

૩-૬ પોરેજ સાથે.

c/o 'Indian Opinion'

P. Bag, Phoenix.

ચાલુ વર્ષના પંચાગ

૨૦૦૮ના ચાલુ વર્ષના

પંચાગ આવી

ગયા છે.

કીમત શી ૫. ૩.

મળવાનું કેાણું આ ઓશીસ

INDIAN OPINION,

P. Bag, Phoenix.

NATAL

વેચવાના પુસ્તકો

- નીતી નાશને મારો (ગાંધીજી) ૨ •
- હીંદુ સ્વરાજ્ય ગાંધીજીના હસ્ત લીખીત છાપમાં અને એક છાપેલી દાદપ કોપી સાથે ૧૦ •
- આરોગ્યતી યાત્રી (ગાંધીજી) ૧ •
- અનાસકતી યોગ (ગાંધીજીને ગીતા લીલા હરેલો અનુવાદ) ૧ ૬
- સરદારનું જીવન ચરીત્ર ૧૩ •
- રાજેન્દ્રપ્રસાદનું જીવન ચરીત્ર ૧૦ •
- આજના તેર દીવસો (બાપુના શ્રાદ્ધ વખતના વિનોબાજીના પ્રવચનો) ૧ ૬
- સરદારનાં લાપછો ૧૨ •
- મારી જીવન કથા (નેહરૂ) ૧૫ •
- દીલ્હી-ડાયરી (ગાંધી) ૧૦ •

આ ઓશીસેથી મળશે.

અમે દરેક જનતા કઠોરની ઢાળો તેમજ તેનો આરો જતીય દેખરેખ નીચે બનાવીએ છીએ તેમજ એક્ષપોર્ટ કરીએ છીએ જેવા કે મગદાળ, અદદાળ છડી. અદદાળ છડીનો આરો, તુવેરદાળ ત્યા ચણાદાળ ચોકખા હાથથીવીલાહ. ચણાનોઆરો ચોકખા કાકરી વખરનો વાદદાળ, વાહ, મઠ મસુરદાળ બાનરી સાક કરેલ ત્યા હડેલી, યોળાદાળ, રાજઅરો, વગેરે ભાવ ત્યા સેમ્પેતી માટે લખો.

AFRICAN DALL & FLOUR MILL.

Tel Address : "DALLMILL"
P. O. Box 888, MOMBASA.
Kenya Colony.

| અંકવાડીક પંચાગ | | | | | | |
|----------------|-----------------------|----------------|--------------|-----------------------|---------------------|---------------|
| વાર | પ્રારતી ૧૯૫૨ જન-ગુઆરી | હીંદુ ૨૦૦૮ પોષ | મુસલમાન ૧૩૭૧ | પારતી ૧૩૨૧ શેહે, કદગી | સુપારત સુપોદય ક.મી. | સુપારત ક. મી. |
| શુક્ર | ૧૯ | ૧૬ | ૬ | ૨૦ | ૧૮ | ૫-૧૨ ૭-૦૧ |
| શની | ૧૯ | " | ૭ | ૨૧ | ૧૯ | ૫-૧૩ ૭-૦૨ |
| રવી | ૨૦ | " | ૮ | ૨૨ | ૨૦ | ૫-૧૪ ૭-૦૩ |
| સોમ | ૨૧ | " | ૯ | ૨૩ | ૨૧ | ૫-૧૫ ૭-૦૪ |
| મંગળ | ૨૨ | " | ૧૦ | ૨૪ | ૨૨ | ૫-૧૬ ૭-૦૫ |
| બુધ | ૨૩ | " | ૧૧ | ૨૫ | ૨૩ | ૫-૧૭ ૭-૦૬ |
| ગુરુ | ૨૪ | " | ૧૨ | ૨૬ | ૨૪ | ૫-૧૮ ૭-૦૭ |

PHONE 33-2651
MASTER BROS.
 MANUFACTURERS OF LADIES' & GIRLS' STRAW & FELT HATS
 WHOLESALE MERCHANTS & DIRECT IMPORTERS
 HOUSE FOR KEEN CASH PRICES
 33 West Street, JOHANNESBURG.
 માર્ટર બ્રધર્સ
 હોલરોલ મરચાંદસ ઓન્ડ ડાયરેક્ટ ઇમ્પોર્ટર્સ
 રેશમી તેમજ સુતરાઈ કાપડ, ડુલન રગ્સ. બ્લાન્કેટ્સ—બેબી બાયકો માટે
 નવ નવનો માલ. તેમજ કેપરીબીન ન્યોરોલ્ટ સાકીઓ
 વગેરે માટે હમારે લાં પ્રથમ તપાસ કરવા બલાયકુ છે
 33 વેસ્ટ સ્ટ્રીટ, જોહાનીસબર્ગ.
 ફોન : ૩૩-૨૬૫૧

Cable & Tel. Add.: "HARGYAN". Phone 29368.
P. HARGOVAN & CO.
 (PTY.) LTD.
 WHOLESALE MERCHANTS
 AND IMPORTERS.
 P. O. BOX 1250.
 155/7 Warwick Avenue
DURBAN.

NATHOO TABHA
 TIMBER & HARDWARE MERCHANT
 & DIRECT IMPORTER
 Door, Windows, Corrugated Iron, Cement,
 Monarch, Iron Duke, Buffalo, and Elephant
 brands paint or any other building material
 at reasonable price.
 Established 1907, NATHOO TABHA,
 107 Queen Street, Phone 24647.
 Telegraph "Mani," DURBAN.

M. J. PATEL
 INTERNATIONAL SPORTS COMPANY
 Importers & Exporters & General
 Commission Agents
 10 Peking Road, KAWOON, HONG KONG.
**Special attention is paid
 to indent orders**
Write To Us For Further Particulars.

PROPERTY
 If you are interested in selling or buying Property in any
 part of Johannesburg or Transvaal please contact:
K. J. TAVARIA
 7 Kort Street, JOHANNESBURG.
 Phone: 339859 or 228727.
 પ્રોપર્ટી
 જોહાનીસબર્ગ અથવા ટ્રાન્સવાલના ના કોઈ પણ ભાગમાં
 પ્રોપર્ટી વેચવી યા ખરીદવી હોય તે માટે:
 કે. જી. તવારીયા,
 ૭ કોર્ટ સ્ટ્રીટ, જોહાનીસબર્ગ.
 ફોન : ૩૩૯૮૫૯ અને ૨૨૮૭૨૭.

ફરનીચર! ફરનીચર!! ફરનીચર!!!
 બેડરૂમ સુટ, ડાઈનિંગરૂમ સુટ, વોર્ડરોબ, હરેસ્ટિંગ ચેર, સ્ક્રીન
 ચોઈ કોફીસ ડેસ્ક, છુક ડેસ્ક, ટેબલ, તદ્દન ક્રીક્રાયટ
 ભાવે ખરીદી શકશો. નવે પધારી લાલ લેવા ચુકશો નહિ.
 —બોક્સ, ટેબલ અને ફીચન હરેસર—
 ને હમારી દેખરેખ નીચે તઈયાર થાય છે. તેનો સ્ટોક હમેશા તઈ-
 યાર રહે છે માત્ર શેક્ડા ભાવોના પ્રાઈસ લીસ્ટ મંજૂરો અને વેપાર
 આગલ વધારો.
L. MISTRY
 51 BREE STREET, BURGERSDORP, J'BURG.
 PHONE 33-4691. BOX 2526.

ધીરૂભાઈ પી. નાયક
 વીમાનાં અને જનરલ એજન્ટ
 હાંદગી, આગ, ચોરી, હુલ્લાડ, અકસ્માત, પેટરોલાસ, વિગેરે
 ના વીમા અગ્રે ઉતરાવી આપીએ છીએ.
 ઈન્કમટેક્સ, પરસનલ ટેક્સ, રેવન્યુ કલેક્ટરના સર્વિસીકેટ અને
 ઈમિગ્રેશનને લગતી આપતોમાં અમારી સલાહ લો.
 Phone : 33-9.33. 29e Commissioner Street,
JOHANNESBURG.

તાજી ઉમલ ફ્રૂટ
 ડરબનનું આજુ ૧/૯ રતલ. ગોરી કલેબું લસણુ શી. ૧ રતલ.
 ગોળ ખાસકીટ ૧૧/- ડગન. લાંબી અને રકવેર ખાસકીટ ૧૬/૬ ડગન.
 પાન, ખનલર ભાવ, પાપડ ૮/૬ ૧૦૦. તથા વેસ્ટ ન્યુસપેપર મળશે.
 હાક રાઇપ બનાના, કાચા બનાના, પોપો પાઇનાપલ, ગ્રેટેડા રોજનના
 બનલર ભાવથી મળશે. દેથી સાકનાછમાં હાલમાં ચુવાર બોડા વેગણુ,
 શેકડાની શીંગ, ડુગા ફુધી તથા લીલાં મરચા. ૭/૬ થી ૧૦/- સુધીનું
 સાકનાછ પારસલ
 પોસ્ટથી મોકલી ન છીએ. દરેક બાનનું કોળ મળશે :
A. KADER & Co., (PTY) LTD.
 WHOLESALE FRUIT MERCHANTS
 P O. Box 251, DURBAN.

वांयवा लायक पुस्तको

| | | | | | | |
|----------------------------------|--------------------------------|-------|---|-------------------------------|-------|---|
| गांधीछत्र साहित्य | समुष्णी कांती | ५ | ० | दुकी वातांमिा अने नवल कथांमिा | १ | ० |
| गांधीछत्रे हजेला अथवा गांधीछ | छवन यंत्रिा | | | यमेदी अने प्रतीमां | ४ | १ |
| ७पर वजायवा पुस्तोमोनी नीजे सभास | मारी छवन कथा जवाहरलालछ | | | विजय वेधवा | ८ | १ |
| याय छे. | | १५ | | अखुतरी वातां संभद | ९ | १ |
| आदर कथा (गांधीछ) | तेज यंत्रिा पांय महान वीरिांना | | | बिागानी वाता | १ | ० |
| ७ | १ | | | मोडान मोधमद नवलकथा | | |
| अभावा आ (ह्दरणा गांधी) | यंत्रिा | ६ | ० | आ. १-२ सेरनी | ११ | ० |
| ४ | ० | | | नय सीक सीकपराज | ११ | ० |
| गांधीछनी सकार साधे | महारेव देहाछत्रुं पुनंयरीर | २ | ३ | अखुतुद भासा | ८ | १ |
| पत्रव्यवहार | सकारा परेव वल्लभभाई परेव | १३ | ० | आसातुं धीज आ. १ २ | | |
| १ | ० | | | सेरनी | १८ | ६ |
| गांधीछनी साधना | मारी छवन कथा राजेन्द्र प्रसाद | | | आवती काळ | ७ | ० |
| ५ | ३ | | | अधसरा (वार भाजो सेर) | १-२-१ | |
| गांधीछना सभासभमां | | १ | ० | अधुनी वाता | १० | ३ |
| ५ | ६ | | | अजो अधा | ११ | ० |
| छवन परेव (श्री. प्रभुदास गांधीजे | केरलाक वांयवा लायक पुस्तके | | | अधुना नोवेव | ७ | ० |
| ११ | ० | | | उधीवाट | ८ | १ |
| प्रीनीकस आश्रम ना उरवेक छतीकास | आपणी क्रिमिस | ४ | ० | धीसा देहा | ३ | ० |
| पोताना छवन परेव इरभ्यान | कंदुने पत्रे (नेदर) | ३ | ० | अजुआ आपु आपुजोना छवनने | | |
| अनेवे आविअयो छे.) | सुप नदी रहेवाय (इअरुदाय) | ५ | ० | उवाड पावती नोवेव | ७ | १ |
| ११ | ० | | | कांय वध | १० | १ |
| गांधीवादी आधुनिक शास्त्रना | इंकी अथवा स'रुती' आधी | २ | ० | केवदाना काटा | ७ | ० |
| ५ | ६ | | | उधवी प्रयोग (वाट संभद) | ७ | १ |
| धर्मात्मा गोभले (गांधीछ) | (साधा कृष्ण) | २ | ० | दीन यर्वा | ७ | १ |
| १ | ६ | | | मेध धी'द (धनिकांमिा) | ७ | १ |
| दक्षिण आग्नीना सत्याग्रहने | छवता तहेवारी (माकासदेव) | ४ | ० | मन्दी | ७ | ० |
| छतीकास | जगतना छतीकासतुं देवा- | | | पयासवर् पजी | ७ | ० |
| ७ | १ | | | आय निमेष (न्यसीअय) | ७ | १ |
| आपुनी प्रसादी | इश'न आ. १-२, (नेदर) | १-२-० | | इंकीनी खुदेषु | ५ | ० |
| (मधुदास नीकमछ) | इअरुदाय अने सीकपु | २ | ० | ठकानी सखयरी | ५ | १ |
| ५ | ० | | | इरीयालाळ | ६ | ० |
| आपुना पत्रे: (आश्रमनी | ज्योतराती विवाही | | | जखु अधु'मि | १ | ० |
| जेना वपर) सं'पाक कथा हावेवकर | (काहा हावेवकर) | १ | ३ | तखुआ (दुकी वातांमिा संभद) | ७ | ० |
| २ | १ | | | दोन इव | ७ | १ |
| पायानी छेवपणी (गांधीछ) | छुद लीला | १ | १ | इरीयाळ' अडार वटीया | ७ | १ |
| ३ | ० | | | इदीयावट | ६ | १ |
| महारेव देहाछनी जायरी | छुद व्यरीय (पव) | ४ | ० | दीरीपनी वाता | १ | ० |
| काग परेवे | नवल अ'थावली | ५ | १ | नील प'धी | ३ | ० |
| १० | ० | | | नीळ देया | ८ | ० |
| " भीजे | जेपीयट रसीया. | १० | ० | अधीकडार | १ | ६ |
| १२ | ६ | | | कुट्टेवा सुव'लु पत्रे | १० | ० |
| " नीजे | (रसीया वीरी लखवा जेव) | १० | ० | असात कीरजुा | ७ | ० |
| ११ | ६ | | | पडेवे काण | ६ | ० |
| " जोयो | जेक रफीअरना कथाने | २ | १ | पियासी | ८ | ० |
| ८ | ६ | | | पौर एडिक नादके | ५ | ६ |
| गांधी विचार देवन गांधीछना | (वातां संभद) | २ | १ | | | |
| विचारने रुपर अर्वा पुस्तक | जुजुरत अडुसद | | | | | |
| २ | १ | | | | | |
| आपुनी ' कारावासी कठालुी | (धरमास धर्म ७पर अजवायु | | | | | |
| (आगाभान महेलना जेकनीस मासेना | पावतुं 'दतुं पुस्तक) | १ | ० | | | |
| छतीकास. वेधीका डे. सुधीला नेपर.) | केरलाका (काहा हावेवकर) | १ | ० | | | |
| कर्मगत शी. १५/०. | कुरमखु यात्रा (" ") | ५ | ० | | | |
| | दिंदी कोमी नीकायु | ६ | ० | | | |
| प्रेम प'थ आ. १ | देहसेराय कृत | | | | | |
| " " " २. | उत्तम नवलकथांमिा | | | | | |
| ६ | | | | | | |
| सम नाम (गांधीछ) | जे नवेवकांमिा | ५ | ० | | | |
| २ | ० | | | | | |
| आंधेवना तेर विपसेा | दृष्टि परीवर्तन (नवलकथा) | ५ | ३ | | | |
| (वीनेलाळ) | शरद आपुनी नवलकथांमिा | | | | | |
| १ | ० | | | | | |
| आपुना-आ ने पत्रे | अपुन'सारती | १२ | १ | | | |
| (ह्दरणा पर वजायवा पत्रे) | अनुवाधा | ६ | ० | | | |
| २ | १ | | | | | |
| केरुवेया सभारक अ'के | ठासीनाथ | ५ | ६ | | | |
| १ | ० | | | | | |
| गांधी सभारक अ'के | अ'कनाथ | ४ | ० | | | |
| २ | ० | | | | | |
| आपुनी अंधी | अरीमदीन | १३ | १ | | | |
| अ'णय असात | जुडी | ७ | १ | | | |
| ३ | ० | | | | | |
| गांधीछनी स'क्षिात अ त म कथा | छवन यात्रा | ४ | ० | | | |
| (* सुदास नीकमछ) | दुमां | ८ | १ | | | |
| २ | ६ | | | | | |
| आंधेव कथ' भावना (गांधीछ) | रेवदास | ५ | ० | | | |
| ५ | ३ | | | | | |
| आश्रम लज्जनावली | अखु वातांमिा | १० | ० | | | |
| १ | ३ | | | | | |
| डीशेरलाळ भराववाला कृत | सुलका | १ | ० | | | |
| उपवधुीने वीहाय डी, ध म. उ | | | | | | |
| गीता अ'धन (नीलाळने सभल | | | | | | |
| साय जेवा रीते वजायुयी हरेडी | | | | | | |
| अयवद | | | | | | |
| ७ | १ | | | | | |
| गदता कवनी (नीलाळना सुजरादी | | | | | | |
| खलीको) | | | | | | |
| १ | ३ | | | | | |
| आं पुस्तक अथोडा (आज हावेवी, | | | | | | |
| पुरभमां वेवादी छुटा वपर पुलना | | | | | | |
| प्रभना जवायुवे ने वेवा वजाया | | | | | | |
| ७ सेना संभद) | | | | | | |
| १ | १ | | | | | |

INDIA INDEPENDENCE NUMBER

Published as Special Number of **INDIAN OPINION** to commemorate the attainment of Freedom by India.

Printed on art paper and profusely illustrated.

With historic pictures connected with India's struggle for Freedom and with photos of the late Dadabhai Naoroji, Tilak Gokhale, Subash Bose and many others who have sacrificed their lives in fighting for freedom and of Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru and many others who have lived to see the fruits of their labour.

Also containing a brief Survey of the work of the Indian National Congress from the time of its inception.

Price 2/-

Tel. Add: "Charotar" Telephone: 33-9885.

MANCHESTER TRADING

—GO. LTD.—

ESTABLISHED 1923

Wholesale Soft & Fancy Goods Merchants

—&—

Direct Importers.

**47, Commissioner Street,
JOHANNESBURG.****LIFE INSURANCE**

Are you adequately insured?

Have you provided for your dependants?

Prepare for the future

Life Insurance gives peace of mind for the unknown future.

Insure with 'THE OLD MUTUAL' your friend for Life—
The S.A. Mutual Life Assurance Society, which has
best Bonus record in the WORLD.

Representative:—

DAYABHAI PATELP.O. Box 1760.
JOHANNESBURG.Phones:— } Business 33-0711
Residence 33-5961**धी न्यु हिल पुश-स्वीट मार्ट**

मेनेजर: मण्डीकार्ड बालुवार्ड कॅरीपोरमार्ग.

हरेक लतनी मीठाईये, बोपभा धीनी तेमल मोपा मेवा,
भसावाथी अमे अनाथीये छीये.अमाइ' वपण्णोके' सुरती कुतु' सेव, भमर, गांठीआ, लछआ,
पातरा विगेरे इरेशेन ताल' अनाथीये छीये.पार्दा वीगेरे मार्टे मोटा प्रभाज्जमां मीठाई मीठाई प्रभाजे दुंके
वपण्णमां अनाथी आपीथु'.

PHONE 33-6575.

P. O. BOX 3680.

THE NEW DIL-KHUSH SWEET MART,

34 President St., Corner Diagonal Street.

JOHANNESBURG.

BOOKS FOR SALE**Shri Aurobindo's Religious Books**

| | | |
|--|----|---|
| HERACLITUS | 3 | 3 |
| IDEAL AND PROGRESS | 3 | 0 |
| THE NATIONAL VALUE OF ART | 3 | 0 |
| BANKIM—TILAK—DAYANANDA | 3 | 6 |
| COLLECTED POEMS AND PLAYS (Part 1 & 2) | 27 | 6 |
| THE RIDDLE OF THE WORLD | 3 | 9 |
| THE BRAIN OF INDIA | 1 | 3 |

Obtainable from:

INDIAN OPINION.

P/Bag, Phoenix, Natal.

PHONE 33-7944. P.O. BOX 4889.

TEL ADDRESS: "ARVIND."

HEAD OFFICE:
409, KRUGER ST., LOUIS TRICHARDT
PHONE 64. PO BOX 106.
TEL. ADD: "KANJEE."**H. K. GOKAL,**

WHOLESALE

GENERAL MERCHANT AND DIRECT IMPORTER.

OUR MOTTO: SERVICE THAT SATISFIES."

43 Market Street,**JOHANNESBRUG.**हिन 33-७९४४.
टेलीमार्शीक अड्रेसमोक्स ४८८९.
"अमरवीन,"हेड ऑफिस:
४०९, क्रुजर स्ट्रीट, लुइसट्रिचार्ड
हिन: ६४ पी. ओ. बॉक्स १०६
टेलीमार्शीक अड्रेस: "कान्जि"**એચ. કે. ગોકળ,**

— શ્રી હોલસેલ વેપારી —

— જનરલ મરચન્ટ અને આયાત કરનાર —

૪૩ મારકેટ સ્ટ્રીટ, જોહાનીસબર્ગ.

BOOKS FOR SALE

| | | | | | |
|---|----|---|---|----|---|
| INDIAN STATESMEN (Devas and Prime Ministers With Portraits) | 7 | 6 | MAHATMA GANDHI (The Man and his Mission, an enlarged and up to date edition of Gandhiji's life.) —By various writers | 6 | 0 |
| INDIAN JUDGES (Biographical and critical sketches with portraits) | 7 | 6 | SOVIET ATTITUDE TOWARDS CHINA Facts And Facts—Stanley Powell | 5 | 0 |
| EMINENT AMERICANS WHOM INDIA SHOULD KNOW—Jabez T. Sunderland | 7 | 6 | AMONG THE GREAT (Conversation with Romain Rolland, Mahatma Gandhi, Bertrand Russell, Rabindranath Tagore and Sri Aurobindo)—Dilip Kumar Roy | 15 | 0 |
| THE BHAGAVAD GITA—The Lord's Song—(An English Translation)—Annie Besant | 1 | 0 | TWO HISTORICAL TRIALS IN RED FORT —An account of the trial of the Officers of the I.N.A. | 11 | 0 |
| WHAT IS WRONG WITH INDIAN ECONOMIC LIFE? —Dr. V. K. R. V. Rao | 8 | 0 | WHY CRIPPS FAILED (Documented account from the Indian Nationalist point of view)—M. Subrahmanyan | 2 | 6 |
| OUR INDIA (Children's stories by various writers, illustrated) —Minoo Masani | 2 | 6 | GANDHI-JINNAH TALKS (Text of Correspondence and other relevant matter) | 2 | 6 |
| COTTAGE INDUSTRIES AND THEIR ROLE IN INDIAN ECONOMY—Prof. Rao | 2 | 6 | INDIAN SCIENTISTS (Biographical Sketches. An account of their researches, discoveries and inventions | 7 | 6 |
| SHAW—WELLS—KEYNES ON STALIN—WELLS TALK (Verbatim Record) | 8 | 6 | LIFE AND GOSPEL OF VIVEKANANDA —Romain Rolland | 13 | 6 |
| GOLDEN NUMBER OF "INDIAN OPINION", 1914 (Souvenir of the Passive Resistance Movement in S.A., 1906-1914) | 4 | 0 | GANDHIJI'S CORRESPONDENCE WITH THE GOVERNMENT (1922-44)—M. K. Gandhi | 5 | 9 |
| THE DELIVERANCE (A picture of the palpitating life of the joint family) | 4 | 6 | THE STORY OF MY EXPERIMENTS WITH TRUTH —M. K. Gandhi | 15 | 0 |
| GANDHIJI AS WE KNOW HIM—Intimate and delightful incidents by various writers | 5 | 0 | CHRISTIAN MISSIONS IN INDIA (Their place in India)—M. K. Gandhi | 5 | 0 |
| PUBLIC FINANCE AND OUR POVERTY —J. C. Kumarappa | 3 | 6 | INDIAN CHRISTIANS (Biographical and critical sketches of poets, publicists of the Church) | 7 | 0 |
| HISTORY OF THE REIGN OF SHAH ALUM —W. Franklin | 7 | 6 | TALES FROM SANSKRIT DRAMATISTS (The famous plays of Bhaasa, Sudraka, Kalidasa, Sri Harsaha, Bhavabhuti and Visakhadatta) | 5 | 0 |
| THE LIFE OF RAMAKRISHNA—An exhaustive account of the Master's wonderful life—Romain Rolland | 15 | 0 | PRACTICE AND PRECEPTS OF JESUS —J. C. Kumarappa | 8 | 6 |
| INDIAN STATES' PROBLEM (Gandhiji's Writings and Utterances)—M. K. Gandhi | 10 | 0 | | | |
| FOUNDATIONS OF PEACE (Critical study of the conditions which precipitated two world wars)—K. T. Shah | 15 | 0 | | | |
| INDIA SPEAKING (Various contributions on economic, political, cultural and social problems of modern India) | 15 | 0 | | | |

Obtainable from:

'Indian Opinion,'
P. Bag, Phoenix, Natal.

Phone 53.

Telegrams 'SOLANKI.'

P.O. Box 208.

Solanki & Co. Ltd.

Merchant & Direct Importers

Extensive range always carried in the following:


Silks, Drapery, Toilets, Perfumes, Curios, Fashion Goods and Jewellery, Wide Range of Indian, Persian and Chinese Carpets.

Stockists of well-known branded Watches.

COPPERBELT PIONEER STORE

Where Quality and Service are Paramount.

Luanshya, Northern Rhodesia.



GOING ON HOLIDAY?

Why not visit East Africa, land of equatorial sunshine but temperate climate. "Skylion" services leave DURBAN for East Africa every Tuesday at 08.15 and follow the smooth coastal route north via Lourenco Marques and Mozambique. They offer you the CHEAPEST smoothest way of making the most of holiday hours in East Africa.

Special Holiday Fares (Return)

Lindi Dar-es-Salaam Mombasa
Durban : £50.14.0 £60.0.0 £68.0.0

THIS TIME—FLY "SKYLION"



Full details from I. A. T. Travel Agents of South African Airways